

એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)



International Year
of Cooperatives

Cooperatives Build a Better World



૯૭ મો

વાર્ષિક અહેવાલ

૨૦૨૫-૨૦૨૬



: હેડ ઓફિસ :

પારસી સ્ટ્રીટ, કિલ્લા પારડી - ૩૯૬ ૧૨૫,

જી. : વલસાડ, (ગુજરાત)



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



સેસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ
(શિક્ષણ બેંક)

બેંકના સ્થાપક પ્રમુખ તથા આજીવન ચેરમેન
(૧૯૩૦ થી ૧૯૪૪)



સરદાર ખાનબહાદુર વિક્રાજી પીરોજશા ભીલાડવાળા

મનશની
(સારા વિચારો)

ગવશની
(સારી વાણી)

કુનશની
(સારા કર્મો)

તા. ૩૧-૩-૨૦૨૬ ની સ્થિતિ

નોંધણી નંબર	: ૬૫૯૦	અધિકૃત શેર ભંડોળ	: રૂ. ૨૦,૦૦,૦૦,૦૦૦
નોંધણી તારીખ	: ૨૩-૧૨-૧૯૨૯	ભરપાઈ થયેલુ શેર ભંડોળ	: રૂ. ૧૫,૯૧,૪૮,૨૦૦
સભાસદ સંખ્યા	: ૪૦૬૭૩	રીઝર્વ તથા અન્ય ફંડો	: રૂ. ૨,૦૩,૨૪,૭૮,૮૧૫
બેન્કની સ્થાપના તારીખ	: ૧-૧-૧૯૩૦	થાપણો	: રૂ. ૧૧,૭૮,૮૮,૫૬,૧૮૭
ઓડીટ વર્ગ	: “અ”	ધીરાણો	: રૂ. ૭,૬૦,૩૦,૫૫,૪૩૯
GSTNo. : 24AABAS 4480 Q1Z0		કામકાજનું ભંડોળ	: રૂ. ૧૯,૩૯,૧૯,૧૧,૬૨૬

❀ હેડ ઓફિસ ❀

કિલ્લા પારડી

ફોન : (૦૨૬૦) ૨૩૭૩૨૭૦, ૨૩૭૩૫૨૮, ૬૩૫૭૯૩૭૬૦૧

E-mail : contact@pardipeoplesbank.in

Web Site : <https://sbpp.bank.in>



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ
(શિક્ષણ બેંક)

:: કસ્ટોડિયનશ્રી ::



શ્રી રાજેશભાઈ ગિરધરભાઈ રાણા
(તા. ૧૮.૦૩.૨૦૨૬ થી)

:: બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ::



શ્રી જીતેન્દ્રકુમાર કાંતીલાલ દેસાઈ
ચેરમેન
(તા. ૦૧.૦૧.૨૦૨૬ સુધી)



શ્રી ભરત કીશુભાઈ પટેલ
ચેરમેન(ઇન્ચાર્જ)
(તા. ૦૨.૦૧.૨૦૨૬ તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)
વાઇસ ચેરમેન
(તા. ૦૧.૦૧.૨૦૨૬ સુધી)



શ્રી અરૂણ શાવકશા સૂઈ
ડિરેક્ટર (પારકી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી કમલેશ ગજાનન પટેલ
ડિરેક્ટર (પારકી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી હેમંત વનમાળીભાઈ ભગત
ડિરેક્ટર (પારકી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી અમિત રમણલાલ દેસાઈ
ડિરેક્ટર (પારકી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી અરવિંદ ઉર્ફે અજય રણછોડજી દેસાઈ
ડિરેક્ટર (પારકી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી હેમંત મનુભાઈ દેસાઈ
ડિરેક્ટર (વાપી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી અજયકુમાર છગનલાલ શાહ
ડિરેક્ટર (વાપી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી દિલીપકુમાર પ્રેમચંદ શાહ
ડિરેક્ટર (વાપી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી દર્પણકુમાર વિનોદરાય દેસાઈ
ડિરેક્ટર (વાપી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી દર્શન અરવિંદભાઈ દેસાઈ
ડિરેક્ટર (વાપી વિભાગ)
(તા. ૦૨.૦૧.૨૦૨૬ તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી મિતેશકુમાર નવનીતલાલ દેસાઈ
ડિરેક્ટર (વાપી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી હર્ષદરાય મોહનલાલ દેસાઈ
ડિરેક્ટર (ઉદવાડા વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી નિરવ (ઉર્ફે રવિ) જશવંતરાય દેસાઈ
ડિરેક્ટર (ઉદવાડા વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી અનિલ ચંદ્ર વિરેન્દ્રભાઈ દેસાઈ
ડિરેક્ટર (ઉમરસાડી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ
(શિક્ષણ બેંક)

:: બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ::



શ્રીમતી કાલ્પાનીબેન રાજન ભટ્ટ
ડિરેક્ટર (મહિલા અનામત)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રીમતી પાર્વલબેન પરેશભાઈ દેસાઈ
ડિરેક્ટર (મહિલા અનામત)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી મનિષકુમાર ખંડુભાઈ પટેલ
ડિરેક્ટર અનુસુચિત જાતિ-અનુસુચિત જનજાતી
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી દિલીપકુમાર ઠાકોરભાઈ દેસાઈ
કો-ઓપ્ટ ડિરેક્ટર (વાપી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી સંજીવ સુરેશચંદ્ર ભટ્ટ
કો-ઓપ્ટ ડિરેક્ટર (પારડી વિભાગ)
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)

:: બોર્ડ ઓફ મેનેજમેન્ટ ::



શ્રી રાજેશભાઈ ગિરધરભાઈ રાઠોડ
ચેરમેન શ્રી
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી જ્યોતેન્દ્રકુમાર કાંતીલાલ દેસાઈ
સભ્ય શ્રી
(તા. ૦૧.૦૧.૨૦૨૬ સુધી)



શ્રીમતી પાર્વલબેન પરેશભાઈ દેસાઈ
સભ્ય શ્રી
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી મિતેશકુમાર નવનીતલાલ દેસાઈ
સભ્ય શ્રી
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)



શ્રી હેમંતકુમાર મનહરલાલ શાહ
સભ્ય શ્રી
(તા. ૦૪.૦૧.૨૦૨૬ સુધી)



શ્રી સંજયકુમાર જશવંતલાલ મહેતા
સભ્ય શ્રી
(તા. ૧૪.૦૩.૨૦૨૬ સુધી)

:: બેંકના અધિકારીશ્રીઓ ::



ડૉ. સિધ્ધાર્થ ટી. શુક્લા
મેનેજિંગ ડિરેક્ટર



શ્રી નિલય બી. દેસાઈ
આસી. જનરલ મેનેજર



શ્રીમતી જ્યોતિ એસ. દેસાઈ
આસી. જનરલ મેનેજર



શ્રીમતી જાગૃતી ડી. શાહ
ચીફ એકાઉન્ટન્ટ



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

:: સત્તાણુ (૯૭) મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ ::

આ ઉપરથી આ બેન્કના સભાસદોને ખબર આપવામાં આવે છે કે સદરહુ બેન્કના સભાસદોની સત્તાણુ મી વાર્ષિક સાધારણ સભા તા. ૦૯-૦૮-૨૦૨૬ ને રવિવાર ના રોજ બપોરે ૨.૩૦ કલાકે પારડી કસ્ટોડિયનશ્રીના આલેલ ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડીટોરીયમ, પ્રજાપતિ વાડીની બાજુમાં, ને. હા. નં. ૮, કિલ્લા-પારડી માં નીચેના કામો કરવા માટે મળશે.

— : રજૂ થનારું કામકાજ :—

૧. તા. ૨૪/૦૮/૨૦૨૫ ના રોજ મળેલ વાર્ષિક સાધારણ સભાના હેવાલને બહાલી આપવા બાબત.
૨. પૂરા થયેલા વર્ષના ભૂતપૂર્વ ડીરેક્ટરોની બોર્ડ / કસ્ટોડિયનશ્રીના કામકાજ સંબંધેનો અહેવાલ તથા તા. ૩૧-૩-૨૦૨૬ (૧-૪-૨૦૨૫ થી ૩૧-૩-૨૦૨૬) ના રોજ પૂરા થયેલા હિસાબી વર્ષના ઓડીટરનો રીપોર્ટ, ઓડીટેડ સરવૈયું અને નફાતોટાનો હિસાબ સ્વીકારવા બાબત.
૩. નફાની વહેંચણી અંગે કસ્ટોડિયનશ્રી કરેલ ભલામણને મંજૂરી આપવા બાબત.
૪. સને ૨૦૨૬-૨૭ ના નાણાંકીય વર્ષ માટે બેન્કના સ્ટેચ્યુટરી ઓડીટરની રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મંજૂરીને આધીન નિમણુંક બાબત.
૫. પેટાનિયમ દ્વારા આવતા વર્ષમાં વધારેમાં વધારે હદ સુધી ડીરેક્ટરોની બોર્ડ / કસ્ટોડિયનશ્રી ભંડોળ એકઠું કરી શકે તે હદ મુકરર કરવા બાબત.
૬. ડીરેક્ટરોની બોર્ડ મિટીંગમાં તથા સબકમિટીઓની મિટીંગમાં હાજરી આપવા માટે ડીરેક્ટરોને (ભવિષ્યમાં થનાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો માટે) મિટીંગ દીઠ આપવાનું હાજરી ભથ્થુ નક્કી કરવા બાબત.
૭. પેટા કાયદામાં સુધારાઓ બાબત.
૮. કસ્ટોડિયનશ્રી તરફથી અને એમની મંજૂરીથી બેન્કના કામકાજને લગતુ જે કામ રજૂ કરવામાં આવે તે.

કિલ્લા -પારડી
તા. : ૨૫-૦૭-૨૦૨૬

કસ્ટોડિયનશ્રી ના હુકમથી
ડૉ. સિદ્ધાર્થ તેજપ્રતાપ શુક્લા
મેનેજિંગ ડીરેક્ટર

નોંધ -

૧. બેન્કના વર્ષ ૨૦૨૫-૨૬ (૧/૪/૨૦૨૫ થી ૩૧/૩/૨૦૨૬) ના હિસાબો સંબંધે જો કોઈ સભાસદને વધુ માહિતી મેળવવી હોય તો બેન્કની પારડી હેડઓફિસમાંથી તે મેળવી લેવી. જો માહિતીથી સંતોષ ન થાય તો જે તે સભાસદે વર્ષ ૨૦૨૫-૨૬ (૧/૪/૨૦૨૫ થી ૩૧/૩/૨૦૨૬) ના હિસાબો સંબંધે જે કંઈપણ ખુલાસા મેળવવા હોય તો બેન્કની પારડી હેડ ઓફિસમાં તા. ૦૫/૦૮/૨૦૨૬ સુધીમાં તે અંગેની લેખિત માંગણી મોકલી આપવી, જેનો યોગ્ય જવાબ મોકલી આપવામાં આવશે. સમય મર્યાદા બાદ આવેલી માંગણી કે વાર્ષિક સભા દરમિયાન મળેલ માંગણી સ્વીકારવામાં આવશે નહીં.
૨. બેન્કની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપવા માટે દરેક સભાસદે તેમનો અસલ ઓળખપત્ર લાવવો ફરજિયાત છે.
૩. બેન્કના પેટાનિયમ ૨૫ મુજબ ઉપરોક્ત વાર્ષિક સાધારણ સભામાં કોરમ થયું નહીં હશે તો સભા ઓછામાં ઓછી અડધો કલાક મુલતવી રાખવામાં આવશે. એ મુલતવી રાખેલ સમય બાદ પણ કોરમ ન થાય તો હાજર રહેલ સભ્યો જોડે મીટીંગ ચાલુ કરી સભામાં કરવાના કામકાજનો નિકાલ કરવામાં આવશે.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિડયુલ્સ બેંક)

કસ્ટોડિયનશ્રીનું નિવેદન

એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ના કસ્ટોડિયનશ્રી રાજેશભાઈ ગિરધરભાઈ રાણાએ પ્રસિધ્ધ કરેલ
૯૭ મી વાર્ષિક સાધારણ સભામાં કસ્ટોડિયનશ્રી નું નિવેદન
માનવંતા સભાસદો,

આપણી બેન્કનો આપ સૌના સાથ-સહકાર થકી ૩૧ મી માર્ચ ૨૦૨૬ વર્ષાન્તે વર્ષ દરમિયાન બેંકે કરેલ બેન્કીંગ
કામકાજનો હિસાબ આપની સમક્ષ રજુ કરતા આનંદ અનુભવુ છું.

સ્થિરતા, સલામતી, પ્રગતિ ની પરંપરા જાળવીને તા. ૩૧-૦૩-૨૦૨૬ ના રોજ આપણી બેન્કે પોતાની બેન્કીંગ
કારકિર્દીના ૯૬ નાણાંકીય વર્ષ પુરા કરી ને ૯૭ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે.

તા. ૩૧-૦૩-૨૦૨૬ ના રોજ પુરા થયેલ નાણાંકીય વર્ષમાં બેન્કે બધા પ્રોવિઝનો તથા ઈન્કમેટેક્સની જોગવાઈ પહેલાનો
બેન્કનો ગ્રોસ નફો રૂ. ૨૩.૪૪ કરોડ માંથી રૂ. ૭.૦૭ કરોડના નેટ પ્રોવિઝનો બાદ કરતા ચોખ્ખો નફો રૂ. ૧૬.૩૭
કરોડ થયેલ છે.

તા. ૦૧-૦૪-૨૦૨૫ થી તા. ૩૧-૦૩-૨૦૨૬ ના હિસાબી વર્ષમાં આપણી બેન્ક ની ડીપોઝીટ રૂ. ૧૧૭૮.૮૮ કરોડ થઈ છે.
તે પૈકી સેવિંગ્સ ડીપોઝીટ રૂ. ૩૫૮.૧૯ કરોડ, કરન્ટ ડીપોઝીટ રૂ. ૯૦.૦૫ કરોડ અને ટર્મ ડીપોઝીટ રૂ. ૭૩૦.૬૪
કરોડ ની છે. કુલ ડીપોઝીટ માં CASA ડીપોઝીટ ૩૮.૦૨ % છે. ડીપોઝીટમાં જંગી વધારો થયેલ છે જેની નોંધ લેવી જરૂરી
બને છે. જે ગ્રાહકોનો બેન્ક પ્રત્યેનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે. ધિરાણો વર્ષાન્તે ૭૬૦.૩૦ કરોડ થયા છે.

તા. ૩૧-૩-૨૦૨૬ ના પૂરા થયેલા હિસાબી વર્ષના ઓડીટેડ સરવૈયા તથા નફા-તોટા ખાતાના હિસાબોને આધારે
કસ્ટોડિયનશ્રી એ કરેલ ભલામણ મુજબ ચોખ્ખા નફાની વહેંચણી બાબત.

અ.નં.	વિગત	રકમ રૂ.
૧.	પેટા નિયમ ૪૨(બી) (૧) મુજબ ૨૫% રકમ રીઝર્વ ફંડ ખાતે લઈ જવી, -u/s 67 GCS ACT	૪,૦૯,૩૩,૬૬૭.૦૦
૨.	પેટા નિયમ ૪૨(બી) (૧) મુજબ ૧૫% રકમ બેડ ડેબ્ટ રીઝર્વ ફંડ ખાતે લઈ જવી, - u/s 67 GCS ACT	૨,૪૫,૬૦,૨૦૦.૦૦
૩.	પેટા નિયમ ૪૨(બી) (૨) મુજબ ૨૦% ડિવિડન્ડ - u/s 68 GCS ACT	૩,૧૮,૨૦,૨૯૮.૦૦
૪.	પેટા નિયમ ૪૨(બી) (૩) મુજબ શિક્ષણ ફાળો - u/s 69 GCS ACT	૩,૦૦,૦૦૦.૦૦
૫.	પેટા નિયમ ૪૨(બી) (૪) મુજબ શેરહોલ્ડર બેનીફીટ ફંડ u/s 70A GCS ACT	૨૦,૦૦,૦૦૦.૦૦
૬.	ઈન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રીઝર્વ (IFR) - RBI Guidelines	૬,૦૦,૦૦.૦૦૦.૦૦
૭.	પેટા નિયમ ૪૨(બી) (સી) (૧) મુજબ બીલ્ડીંગ ફંડ	૦.૦૦
૮.	Celebration of 100 Years For Share Holders Benefit	૧૦,૦૦.૦૦૦.૦૦
૯.	સાઈબર સીક્યુરીટી રીઝર્વ ફંડ RBI Guidelines	૧૦,૦૦.૦૦૦.૦૦
૧૦.	પેટા નિયમ ૪૨(સી) (૫) મુજબ રીઝર્વ ફંડ ખાતે	૨૧,૨૦,૫૦૧.૮૮
	ટોટલ	૧૬,૩૭,૩૪,૬૬૬.૮૮

ઓડીટ વર્ગ -

સરકારશ્રી દ્વારા નિયુક્ત સ્ટેચ્યુટરી ઓડીટરશ્રી દ્વારા આપણી બેન્કને “એ” ગ્રેડ આપવામાં આવ્યો છે.

શેર ભંડોળ, રીઝર્વ ફંડ તથા સભાસદ સંખ્યા -

તા. ૩૧-૦૩-૨૦૨૬ ના રોજ નું શેર ભંડોળ રૂ. ૧૫.૯૧ કરોડ, બેન્કનું સ્ટેચ્યુટરી રીઝર્વ રૂ. ૯૨.૨૩ કરોડ, બેન્કના
ટોટલ રીઝર્વ ફંડો રૂ. ૨૧૩.૧૫ કરોડના થયા છે. બેન્કના સભાસદોની સંખ્યા વર્ષાન્તે ૪૦૬૭૩ રહી હતી.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિડયુલ્સ બેંક)

લિક્વીડિટી અને ઇન્વેસ્ટમેન્ટ -

તા. ૩૧-૦૩-૨૦૨૬ ના રોજ બેન્કનો SLR રીઝર્વ બેન્કની ગાર્ડલાઈન્સ પ્રમાણેની જરૂરીયાત કરતા રૂ. ૨૧૩.૬૮ કરોડ વધુ રાખેલ છે તથા ગવર્નમેન્ટ સીક્યુરીટી, લીક્વિડ મ્યુચ્યુઅલ ફંડ તથા બેન્ક થાપણો વિગેરે મળીને કુલ ઇન્વેસ્ટમેન્ટ રૂ. ૫૮૬.૩૪ કરોડનું થયું છે.

કેપીટલ એડીક્વશી રેશિયો -

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના લઘુત્તમ ધોરણ ૧૨% ની સરખામણીએ તા. ૩૧-૦૩-૨૦૨૬ ના રોજનો કેપીટલ એડીક્વેશી રેશિયો ૨૧.૭૩% જાળવેલ છે.

કન્ટીજન્સી રીઝર્વ ફંડ - બેન્ક પાસે રૂ. ૨૮.૩૪ કરોડ નું કન્ટીજન્સી રીઝર્વ ફંડ છે. તા. ૩૧-૦૩-૨૦૨૬ ના રોજની નેટ વર્થ રૂ. ૧૫૦.૦૫ કરોડ છે.

રીકવરી અને ઓવરડ્યુ -

બેન્કના સુદૃઢ પ્રયાસોના કારણે બેન્કનું ગ્રોસ એન.પી.એ. કુલ ધિરાણના ૫.૩૪% રહેલ છે. વર્ષ દરમિયાન ધિરાણના હપ્તા તથા વ્યાજની રીકવરી રૂ. ૨૨૪.૩૬ કરોડ થઈ હતી. જે પૈકી એન.પી.એ. ખાતાની કુલ રીકવરી રૂ. ૩.૪૪ કરોડ હતી. ધિરાણની સમયસર થતી રીકવરી બેન્કની નાણાંકીય મજબુતાઈ તથા તરલતા બાબતે મહત્વનો ભાગ ભજવે છે જે બાબતે બેન્કે ધિરાણની રીકવરી માટે સખત અભિગમ રાખેલ છે જે બાબતે બેન્ક જપ્તી-વેચાણ જેવા અત્યંત જરૂરી પગલાઓ લઈ રહી છે. યોગ્ય કિસ્સામાં બેન્ક સહાનુભૂતિ દર્શાવે છે પરંતુ ઇરાદાપૂર્વક ધિરાણના નાણાં ન ભરનાર ને આ સાથે બેન્ક ચેતી જવા અનુરોધ કરે છે. આથી સર્વે સભાસદ-ગ્રાહકોને ધિરાણના રીપેન્ટમાં નિયમિત રહેવા અપીલ કરવામાં આવે છે.

ગ્રાહક સેવા -

ગુજરાત રાજ્ય ના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ના પ્રયત્નોથી તથા બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્યો તથા સ્ટાફ ના અવિરત પ્રયત્નો થી સરકારશ્રી તરફથી એસબીપીપી બેન્ક નું નામ Banks for acceptance of bank guarantee ના લીસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે. જેનાથી બેન્ક ગર્વમેન્ટ ઓફ ગુજરાત ના વિવિધ વિભાગો દ્વારા કાઢવામાં આવતા ટેન્ડર માં સિક્યોરિટી ડિપોઝિટ તથા Earnest Money Deposit (EMD) માટે બેન્ક ગેરંટી ઇસ્યુ કરી શકશે.

બેન્કના ATM / Debit Card દ્વારા ATM ઉપરાંત POS અને ECOM સેવાનો લાભ લઈ શકાય છે. સ્માર્ટ ફોન દ્વારા નાણાંકીય વ્યવહાર (IMPS/RTGS/NEFT) ચેકબુક રીકવેસ્ટ, બેલેન્સ ઇન્કવાયરી અને સ્ટેટમેન્ટ રીકવેસ્ટ મેળવી શકે એ માટે "APP" લોન્ચ કરવામાં આવેલ છે. ATM / Debit Card ના મેનેજમેન્ટ માટે Card Safe Application લોન્ચ કરવામાં આવેલ છે. આ સેવાનો વધુમાં વધુ ગ્રાહકોને લાભ લેવા વિનંતી.

બેંકની દરેક શાખાઓમાં ગુજરાત ગેસ કું., લી. ના રૂપિયા ૧૦, ૦૦૦/- સુધીના બીલો સ્વીકારવામાં આવે છે.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિડયુલ્સ બેંક)

બેન્ક એ RBI ના Central Payment System માં direct membership માટેની પ્રક્રિયા ચાલુ કરેલ છે જે પ્રક્રિયા પૂર્ણ થતા નજીકના ભવિષ્યમાં 24*7 RTGS/NEFT ની સુવિધાનો ઉપયોગ કરી શકશે

ઈન્સ્યુરન્સની કામગીરી માટે કોર્પોરેટ એજન્સી કોડ લેવાની પ્રોસેસ શરૂ કરેલ છે અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન ના બિઝનેસ માટે ARN કોડ લીધેલ છે. બેન્ક દ્વારા NJ India સાથે Mutual Fund distribution માટે Tie up કરી Mutual Fund નો લાભ ગ્રાહકોને બેન્ક માં જ મળી શકે એ ઉદ્દેશ્યથી સેવા ચાલુ કરવામાં આવેલ છે.

ધી ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કું. દ્વારા સભાસદો માટે રૂ. ૨,૦૦,૦૦૦/- ની એક્સીડન્ટ ઈન્સ્યુરન્સ પોલિસી ચાલુ છે.

બેન્ક દ્વારા સભાસદો ને વૈદકીય રાહત યોજના હેઠળ મળતી સહાયની મહત્તમ મર્યાદા રૂ. ૧૨,૦૦૦/- તથા સભાસદ કલ્યાણ યોજના હેઠળ મૃત્યુ પામેલ સભાસદો ના વારસદાર ને મળતી મૃત્યુ સહાય ની મહત્તમ મર્યાદા રૂ. ૭,૫૦૦/- માં આપવામાં આવે છે.

માધવપૂરા મર્કન્ટાઈલ કો. ઓપરેટીવ બેન્કમાં FD ના અટવાયેલ નાણાં પૈકી વર્ષ દરમિયાન રૂ. ૭૦.૦૦ લાખ આ નાણાકિય વર્ષ દરમિયાન આવેલ છે.

પારનેરા શાખાનું નવા મકાન નું બાંધકામ પૂર્ણ થતાં તા. ૨૨-૧૧-૨૦૨૫ ના રોજ નવા મકાનમાં સ્થળાંતર કરેલ છે. જેમા ATM ની સુવિધા ઉપલબ્ધ છે.

સ્ટાફ દ્વારા તેમને આપેલ ટાર્ગેટ પૂર્ણ કરવા બદલ Prize Distribution નો કાર્યક્રમ તા. ૩૦-૦૫-૨૦૨૬ ના રોજ રાખવામાં આવેલ હતો, જેમાં કસ્ટોડિયનશ્રી, સ્ટાફ સભ્યો, માજી ડીરેક્ટરશ્રીઓ તથા માજી બોર્ડ ઓફ મેનેજેન્ટ ના સભ્યોએ હાજરી આપી સ્ટાફને આજ રીતે કામગીરી કરીને બેંકને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે પ્રેરણા આપી હતી.

આખા દેશમા અસ્તિત્વ ધરાવતી ૧૪૦૦ થી વધુ કો ઓપરેટીવ બેન્કોમાંથી માત્ર ૮૪ જ બેંકો Tier-3 માં સ્થાન ધરાવે છે, જે પૈકી આપણી બેંકે પણ Tier-3 માં સ્થાન મેળવેલ છે જે આપણા માટે ગૌરવ ની વાત છે.

DBTL (ડાયરેક્ટ બેનીફીટ ટુ LPG કસ્ટમર) -

આ સેવા થકી ગ્રાહકો તેમના ગેસ સબસીડીની રકમ આપણી બેન્કના તેમના ખાતામાં જમા મેળવી શકશે.

D.I.C.G.C પ્રિમીયમ -

બેન્ક ડીપોઝીટ ઈન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશનને (D.I.C.G.C) તા. ૩૦-૦૯-૨૦૨૬ સુધી નું એડવાન્સ પ્રિમીયમ બેન્કે ભરી દીધેલ છે, ડીપોઝીટ ઈન્સ્યુરન્સ એક્ટ હેઠળ આપણી બેન્કની રૂ. ૫.૦૦ લાખ સુધીની થાપણો, રાષ્ટ્રીકૃત બેન્કની જેમ જ સુરક્ષિત છે.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિડયુલ્સ બેંક)

પ્રકીર્ણ -

મને જણાવતાં અત્યંત દુઃખ થાય છે, આપણી બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્યશ્રી હેમંતભાઈ એમ. શાહ નું તા. ૦૪-૦૧-૨૦૨૬ ના રોજ દુઃખદ અવસાન થયું છે. તથા આપણી બેંકના માજી ચેરમેન શ્રી અરવિંદભાઈ પી. દેસાઈ તથા શ્રી જવાહરભાઈ દેસાઈ નું દુઃખદ અવસાન થયેલ છે. એમણે બેંક ની પ્રગતિ માટે જે યોગદાન આપ્યું છે તથા જાહેર જીવનમાં આપેલ સેવાઓની આ તકે નોંધ લઈ એમના પરિવારજનોને સહાનુભૂતિ પાઠવું છું.

વર્ષ દરમિયાન હેડ ઓફિસના બોર્ડ સેક્રેટરી તરીકે કાર્યરત શ્રી હિતેન વી. શાહ, પારડી પ્રાંચના પ્રાન્ય હેડ શ્રી સુરેશભાઈ એન આહિર, વાપી ટાઉન પ્રાન્યના સીનીયર ઓફિસર શ્રીમતી ભાવિકાબેન પી. દેસાઈ, ઉદવાડા પ્રાંચના સીનીયર ઓફિસર શ્રીમતી શીલાબેન એસ. દેસાઈ, પારડી પ્રાંચના પ્યૂન શ્રી કમલેશભાઈ પી. પ્રજાપતિ, ઉદવાડા પ્રાંચના પ્યૂન શ્રી પ્રવીણભાઈ એમ. ભંડારી લાંબી સર્વિસ બાદ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલ છે. તેમજ ભીલાડ પ્રાન્યના સિનિયર ઓફિસર શ્રી સમીર એન. દેસાઈ, જુઆઈડીસી વાપી પ્રાંચના જુનિયર ઓફિસર શ્રીમતી નિકિતા જી. પુરોહિત હેડ ઓફિસના જુનિયર ઓફિસર શ્રીમતી મનાલી ડી. પટેલ અને ચણોદ પ્રાંચના જુનિયર ઓફિસર ફોરમ કે દેસાઈ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી ફરજ નિવૃત્ત થયેલ છે. તેઓ સૌની બેન્ક પ્રત્યેની સેવાની નોંધ લઈ એમનું આગળ નું જીવન અને કારકિર્દી સુખમય રહે એવી શુભેચ્છા.

વર્ષ દરમિયાન મેનેજમેન્ટ તથા કર્મચારીઓના ધનિષ્ઠ પ્રયત્નોથી તથા ગ્રાહકોના સહયોગ થી ગત વર્ષ કરતાં NPA માં ટકાવારીમાં ૦.૧૩% નો ઘટાડો થયેલ છે.

બેન્કના રોજબરોજના કામકાજમાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીશ્રીઓ દ્વારા, નામદાર ગુજરાત સરકારના સહકારી વિભાગના અધિકારીશ્રીઓ, રજીસ્ટારશ્રીઓ, સ્ટેચ્યુટરી ઓડીટરશ્રી તથા બેન્કના નિયુક્ત કરેલ કન્સલ્ટન્ટો દ્વારા વખતો વખત આપવામાં આવેલ સુચનો, સલાહ- મશવરાને ધ્યાનમાં લઈ એમનો આભાર વ્યક્ત કરું છું.

બેન્કના સભાસદો, થાપણદારો, ગ્રાહકો તથા શુભેચ્છકો દ્વારા બેન્ક પ્રત્યેના સંપૂર્ણ વિશ્વાસ દાખવી બેન્કની સધ્ધરતાને મજબુતી આપી રહ્યા છો એની કદર સમજી દરેકનો હું આભાર માનું છું.

બેન્કના માજી ડિરેક્ટરશ્રીઓ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના માજી સભ્યો દ્વારા સંચાલનમાં વખતો વખત બેન્કના કામકાજના નીતિ-વિષયકો તથા પ્રગતિના નિર્ણયો લેવામાં આવેલ છે. તે હું બિરદાવું છું.

છેવટે આપ સૌ નો સાથ અને સહયોગ હર્મેશ પ્રગતિને આવકારે છે જે અડગ વિશ્વાસની આશા સાથે વિરમું છું.

જય સહકાર - જયહિંદ

કિલ્લા પારડી

શ્રી રાજેશભાઈ ગિરધરભાઈ રાણા
કસ્ટોડિયન



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ
(શિડયુલ્સ બેંક)

KNOW YOUR BANK

BANK NAME : SBPP CO OPERATIVE BANK LTD

BANK CODE : 08664701

PAN : AABAS4480Q

GST NO : 24AABAS4480Q1Z0

TAN : SRTS04045G

DICGC CODE : 43016

LEI NO : 335800DX6NNKLCWIAL93

BRANCH : 11 + 1 HEAD OFFICE

EMAIL : contact@pardipeoplesbank.in

CONTACT NO : 6357937601

WEBSITE : <https://sbpp.bank.in>

ADMIN OFFICE : PARSI STREET, KILLA PARDI, 396125.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

એનેક્સર:ઈ ઓડીટર્સ રીપોર્ટ

પ્રતિ,

સભાસદશ્રી, તમામ

એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લી. કિલ્લા પારડી, જી.વલસાડ

આપની બેંકના હિસાબી વર્ષ ૨૦૨૫-૨૬ ના સ્ટેચ્યુટરી ઓડીટર તરીકે અમારી નિમંણુક આર. બી. આઈ ના તા. ૦૬/૦૬/૨૦૨૪ ના પત્ર થી કરવામાં આવેલ હતી. પત્રની શરતોને આધીન અમોએ અમારી ઓડીટ કામગીરી બેંક દ્વારા વખતો વખત પુરી પાડવામાં આવેલ માહિતીના આધારે પુર્ણ કરેલ છે. આ સંસ્થાનું પાકું સરવૈયું નફા-નુકશાન પત્રક તથા હિસાબી દફતરની ચકાસણી કરી નીચે મુજબ અહેવાલ રજૂ કરીએ છીએ.

- (૧) બેંકની વ્યવસ્થાપક સમીતી દ્વારા બેંકનો વહીવટ સહકારી કાયદા-કાનુનની જોગવાઈઓ અને પેટા નિયમને આધીન રહી ને ચલાવવામાં આવે છે. અને કાયદા-કાનુનની જોગવાઈઓનું સમીતી દ્વારા પાલન થયેલ છે.
 - (૨) બેંકની વ્યવસ્થાપક સમીતી દ્વારા આર. બી. આઈ. ના વખતો વખતનાં સરકયુલર્સ/ઠરાવો અને માર્ગદર્શક સુચનાઓ વિગેરેનું પાલન કરવામાં આવે છે.
 - (૩) બેંકમાં હિસાબી દફતર વાર્ષિક હિસાબો/હિસાબી પદ્ધતિ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સુચના/સહકારી કાયદાની જોગવાઈ સંદર્ભે નિભાવવામાં આવેલ છે.
 - (૪) બેંકનું સરવૈયું બેંકની આર્થિક સ્થિતિનું વાસ્તવિક ચિત્ર દર્શાવે છે. સરવૈયામાં દર્શાવેલ મુડી દેવા અને મિલકત-લેણા નફા-નુકશાનની પરિસ્થિતિ વાસ્તવિક અને ખરી છે.
 - (૫) બેંક દ્વારા એસ.એલ. આર. અને સી. આર. આર. ના ધોરણ જળવાયેલ છે.
 - (૬) બેંક દ્વારા આર. બી. આઈ. ની એન. પી. એ. અંગેની ગાર્ડ લાઈન્સ મુજબ મિલકતોનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. અને તે અંગે પર્યાપ્ત જોગવાઈ કરવામાં આવેલ છે.
 - (૭) બેંકના વ્યવસ્થાપક મંડળના સભ્યોને અને તેમનાં કુટુંબીજનો ને કરવામાં આવેલ ધિરાણ આર.બી.આઈ. ની સુચના તથા સહકારી કાયદા કાનુનની જોગવાઈઓ અનુસાર કરવામાં આવેલ છે તેમજ તમામ ધિરાણ વસુલાત આવી શકે તેમ છે.
 - (૮) બેંકના નીચે જણાવેલ હોદ્દાઓ / કે ડીરેક્ટર્સશ્રી સિવાય અન્ય કોઈ દ્વારા સહકારી કાયદા-કાનુન કે પેટો નિયમોની જોગવાઈ મુજબ ગેરલાયકાત વ્હોરેલ નથી.
- ડિરેક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ ને તારીખ ૨૯-૦૫-૨૦૧૯ ની ડિરેક્ટર બોર્ડ મિટિંગ મા ઠરાવ નંબર ૨/૫ થી બેંકના ડિરેક્ટર તરીકે ખરતરફ કરવામાં આવેલ છે. જેની સામે શ્રી ધર્મેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ એ વાદી તરીકે વલસાડ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ માં દાવા ન. ૬૯/૧૯ દાખલ કરેલ છે જે કેસ હાલમાં ચાલુ છે.
- (૯) બેંકના કાર્યવાહકો દ્વારા વનટાઈમ સેટલમેન્ટ યોજના કે ડીપોઝીટ સેટ ઓફ યોજનાની ગાર્ડ લાઈન્સનું પાલન કરવામાં આવેલ છે.
 - (૧૦) હિસાબી વર્ષ દરમિયાન લેણાં માંડવાળ કરવાના કિસ્સાઓમાં આર. બી. આઈ. તથા સહકાર ખાતા દ્વારા ઈસ્યુ કરેલ સુચનાઓનું પાલન કરવામાં આવેલ છે.
 - (૧૧) કોર્ટ રાહે સમાધાન માંડવાળના કિસ્સાઓમાં સંસ્થાનું નાણાંકીય હિત જોખમાયેલ નથી.

સીલ

સ્થળ: વાપી

તારીખ: ૧૮/૬/૨૦૨૬

અન્વેષકનું નામ : શ્રી સ્પેશ એન્ડ કુાં.

હોદ્દો : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

પેનલ નંબર : UCN 1002965

નોંધ: સદરહુ ઓડીટર્સ રીપોર્ટ સંસ્થાના વાર્ષિક હિસાબોમાં છપાવી પ્રસિધ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા સી.ઈ.ઓ./જનરલ મેનેજરશ્રીને વિનંતી છે.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવૈયું

તા. ૩૧-૩-૨૦૨૫ રૂા. પૈસા.	ભંડોળ અને દેવું	રૂા. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૬ રૂા. પૈસા.
૨૦,૦૦,૦૦,૦૦૦.૦૦	૧. શેર ભંડોળ ૧) અધિકૃત શેરભંડોળ ૨૦,૦૦,૦૦૦ શેર પ્રત્યેક શેર રૂા. ૧૦૦/- ના ૨) ભરાયેલુ શેર ભંડોળ ૧૫,૯૧,૪૮૨ શેર પ્રત્યેક શેર રૂા. ૧૦૦/- ના ૩) માંગેલ શેર લેસ કોલ અનપેડ ઉપર મુજબ રાખવામા આવેલ (અ) વ્યક્તિઓએ ધારણ કરેલ (બ) સહકારી સંસ્થાઓએ ધારણ કરેલ (ક) રાજ્ય સરકારશ્રીએ ધારણ કરેલ	૨૦,૦૦,૦૦,૦૦૦.૦૦	૨૦,૦૦,૦૦,૦૦૦.૦૦
૧૬,૦૬,૩૨,૮૦૦.૦૦		૧૫,૯૧,૪૮,૨૦૦.૦૦	૧૫,૯૧,૪૮,૨૦૦.૦૦
૧૬,૦૬,૩૨,૮૦૦.૦૦		૧૫,૯૧,૪૮,૨૦૦.૦૦	૧૫,૯૧,૪૮,૨૦૦.૦૦
૧૬,૦૬,૩૨,૮૦૦.૦૦ ૦.૦૦ ૦.૦૦		૧૫,૯૧,૪૮,૨૦૦.૦૦ ૦.૦૦ ૦.૦૦	૧૫,૯૧,૪૮,૨૦૦.૦૦
૧,૮૨,૦૮,૬૫,૪૬૩.૨૬ ૮૫,૪૨,૬૫,૦૬૭.૮૫ ૦.૦૦ ૮,૦૦,૦૦,૦૦૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૪૨,૮૬,૧૫,૨૯૮.૮૨ ૫૯,૮૭,૭૩૮.૭૪ ૨,૦૦,૪૩૨.૮૨ ૧૩,૪૪,૬૩૮.૫૮ ૨,૭૮,૦૦,૦૦૦.૦૦ ૨૯,૦૪,૮૦,૫૫૭.૯૨ ૧૯,૨૦,૦૮૨.૦૦ ૧૧,૯૯,૪૧,૨૬૦.૫૩ ૯૪,૧૦,૩૮૬.૦૦ ૧૦,૦૦,૦૦૦.૦૦	૨. રીઝર્વ ફંડ અને અન્ય રીઝર્વસ ૧. રીઝર્વ ફંડ ૨. ખેતી વિષયક ફંડ ૩. ઇમારત ફંડ ૪. ડીવીડન્ડ ઇક્વીલાઇઝેશન ફંડ ૫. કુળત લેણાં સામે ખાસ રીઝર્વ ૬. કુળત અને શકમંદ લેણા સામે રીઝર્વ ૭. રોકાણોના ઘસારા સામે રીઝર્વ ૮. અન્ય ફંડ તથા રીઝર્વસ ૧. ધર્માદા ફંડ ૨. સભાસદ કલ્યાણ ફંડ ૩. સ્ટાન્ડર્ડ એસેટ સામે પ્રોવિઝન ૪. કન્ટીન્યુઅન્સી રીઝર્વ ફંડ ૫. અકસ્માતોના ઘટાડા સામેનું રીઝર્વ ૬. રોકાણોના વધ-ઘટ સામેનું રીઝર્વ ૭. લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ રીઝર્વ સ્પેશયલ રીઝર્વ U/S 36(1)(viii) ઓફ ઈ. ટેક્સ એક્ટ 1961 ૮. સાયબર સિક્યુરિટી રિઝર્વ ફંડ ૩. મુખ્ય ગૌણ રાજ્ય ભાગીદારી ફંડ ખાતું મધ્યસ્થ સહકારી બેંકના શેર ભંડોળ માટે ખેતી વિષયક પ્રથામિક ક્રેડીટ મંડળીઓના શેર ભંડોળ માટે અન્ય મંડળીઓના શેર ભંડોળ માટે	૯૨,૨૨,૯૭,૮૬૦.૬ ૦.૦૦ ૧૩૦૦૦૦૦૦૦ ૦.૦૦ ૦.૦૦ ૪૬,૩૧,૧૫,૨૯૮.૮ ૯,૫૬,૧૮,૮૭૦.૭૪ ૧૦,૦૦,૦૦૦ ૨,૦૦,૪૩૨.૮૨ ૪૩,૭૧,૮૦૮.૫૮ ૨,૭૮,૦૦,૦૦૦.૦૦ ૨૮,૩૪,૮૦,૫૫૭.૯ ૧૯,૨૦,૦૮૨ ૯,૧૨,૬૩,૫૧૭.૫૩ ૯૪,૧૦,૩૮૬ ૨૦,૦૦,૦૦૦	૨,૦૩,૨૪,૭૮,૮૧૫.૦૦
૧,૯૮,૧૫,૯૮,૨૬૩.૨૬	સરવાળો આગળ લઈ ગયા		૨,૧૯,૧૬,૨૭,૦૧૫.૦૦



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવૈયું

તા. ૩૧-૩-૨૦૨૫ રૂા. પૈસા.	મિલકત અને લેણું	રૂા. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૬ રૂા. પૈસા.
૪,૪૮,૩૩,૧૩૧.૦૦ ૪૩,૦૫,૪૮,૩૭૮.૮૮	૧. રોકડ હાથ ઉપર અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રાજ્ય સહકારી બેંક, જિલ્લા સહકારી બેંકમાં અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ચાલુ ખાતે (૧) હાથ ઉપર (૨) ચાલુ થાપણોમાં	૫,૫૫,૮૪,૮૪૪.૦૦ ૩૬,૮૫,૬૦,૨૬૪.૫૦	૪૨,૪૧,૪૫,૧૦૮.૫૦
૪૭,૬૦,૩૫,૮૩૪.૯૨ ૧,૨૮,૩૩,૨૬,૩૮૦.૯૨	૨. અન્ય બેંકોમાં સિલક (૧) ચાલુ થાપણો (૨) બચત બેંક થાપણો (૩) મુદતી થાપણો	૩૮,૬૪,૧૫,૦૭૨.૦૩ ૧,૪૭,૨૬,૪૨,૫૮૦.૯૨	૧,૮૫,૮૦,૫૭,૬૫૨.૯૫
૩,૨૧,૮૭,૫૭,૧૫૭.૫૬	૩. ટુંકી મુદત અને કોલ નોટીસ રકમ ૪. રોકાણો ૧. મધ્યસ્થ અને રાજ્ય સરકારની જામીનગીરીઓમાં (બુક વેલ્યુ) દાર્શનિક કિંમત બજાર કિંમત ઓફ વીચ એચટીએમ દાર્શનિક કિંમત એચટીએમ બુક કિંમત એચટીએમ બજાર કિંમત એએફએસ દાર્શનિક કિંમત એએફએસ બુક કિંમત એએફએસ બજાર કિંમત ૨) અન્ય ટ્રસ્ટી જમીનગીરીઓ ૩) સહકારી સંસ્થાઓના શેરો નીચેના આઈટમ ૫ સિવાય ૪) અન્ય રોકાણો (વિગત પરિશિષ્ટ મુજબ) ૫. મુખ્ય ગૌણરાજ્ય ભાગીદારી ફંડનું રોકાણ ૧) મધ્યસ્થ સહકારી બેંક શેરોમાં ૨) ખેતી વિષયક પ્રાથમિક ક્રેડીટ મંડળીઓના શેરોમાં ૩) અન્ય મંડળીઓના શેરોમાં *જેમાં રીઝર્વ ફંડોનો રોકાણોનો સમાવેશ થાય છે.	૪,૨૮,૦૭,૫૩,૨૭૮.૫૬ ૪,૩૧,૮૦,૦૭,૦૪૪.૦૦ ૪,૧૮,૮૮,૫૮,૧૭૦.૭૫ ૨,૬૦,૮૩,૩૦,૦૦૦.૦૦ ૨,૫૬,૫૫,૫૮,૪૪૨.૦૦ ૨,૫૬,૮૨,૭૬,૭૦૪.૦૨ ૧,૭૦,૮૬,૭૭,૦૪૪.૦૦ ૧,૭૨,૫૧,૮૪,૮૩૬.૫૬ ૧,૬૨,૮૫,૮૧,૪૬૬.૭૩ ૫,૦૦૦.૦૦ ૭૦,૫૦૦.૦૦ ૧૦,૦૦,૦૦,૦૦૦.૦૦	૦.૦૦ ૪,૩૬,૦૮,૨૮,૭૭૮.૫૬ ૦.૦૦
૫,૪૫,૩૫,૦૦,૮૮૩.૨૮	સરવાળો આગળ લઈ ગયા		૬,૬૭,૪૦,૩૧,૫૪૦.૦૧



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિડયુલ્સ બેંક)

તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવૈયું

તા. ૩૧-૩-૨૦૨૫ રૂા. પૈસા.	બંડોળ અને દેવું	રૂા. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૬ રૂા. પૈસા.
૧,૯૮,૧૫,૯૮,૨૬૩.૨૬ ૧૦,૨૭,૩૫,૫૩,૧૩૭.૭૦ ૬,૦૮,૬૭,૫૬,૧૦૨.૦૬ ૬,૦૦,૫૮,૩૧,૩૩૫.૦૬ ૦.૦૦ ૮,૦૯,૨૪,૭૬૭.૦૦ ૩,૩૪,૬૧,૬૯,૭૪૨.૩૬ ૩,૩૪,૫૭,૨૨,૭૮૨.૫૧ ૦.૦૦ ૪,૪૬,૯૫૯.૮૫ ૮૪,૦૬,૨૭,૨૯૩.૨૮ ૮૦,૭૩,૦૯,૮૫૫.૧૨ ૦.૦૦ ૩,૩૩,૧૭,૪૩૮.૧૬ ૦.૦૦	સરવાળો આગળ લાવ્યા... ૪. થાપણો અને અન્ય ખાતાઓ ૧. મુદતી થાપણો અ. વ્યક્તિઓની બ. મધ્યસ્થ સહકારી બેંકોની ક. અન્ય મંડળીઓની ૨. ખચત થાપણો અ. વ્યક્તિઓની બ. મધ્યસ્થ સહકારી બેંકોની ક. અન્ય મંડળીઓની ૩. ચાલુ થાપણો અ. વ્યક્તિઓની બ. મધ્યસ્થ સહકારી બેંકોની ક. અન્ય મંડળીઓની ૪. કોલ અને ટુંકી મુદતની થાપણો ૫. કરજ ૧. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા/રાજ્ય અને મધ્યસ્થ સહકારી બેંકમાંથી (અ) ટુંકી મુદતની લોન/રોકડ શાખ અને ઓવર ડ્રાફ્ટ પૈકી ૧. સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે ૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે (બ) મધ્યમ મુદતની લોન પૈકી ૧. સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે ૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે (ક) લાંબી મુદતની લોન પૈકી ૧. સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે ૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે ૨. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી (અ) ટુંકી મુદતની લોન/રોકડ શાખ અને ઓવર ડ્રાફ્ટ પૈકી ૧. સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે ૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે (બ) મધ્યમ મુદતની લોન પૈકી ૧. સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે ૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે (ક) લાંબી મુદતની લોન પૈકી ૧. સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે ૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે ૩. રાજ્ય સરકાર પાસેથી (અ) ટુંકી મુદતની લોન પૈકી ૧. સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે ૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે (બ) મધ્યમ મુદતની લોન પૈકી ૧. સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે ૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે (ક) લાંબી મુદતની લોન પૈકી ૧. સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે ૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે ૪. અન્ય રીતે મેળવેલ લોન અભ્યાસક્રમો અને સુરક્ષાનો ઉલ્લેખ કરવો.	૭,૩૦,૬૩,૮૬,૪૪૯.૯૫ ૭,૧૭,૬૩,૦૧,૫૦૦.૯૫ ૦.૦૦ ૧૩,૦૦,૮૪,૯૪૯.૦૦ ૩,૫૮,૧૯,૧૮,૩૮૯.૫૭ ૩,૫૭,૯૨,૪૨,૬૩૨.૧૮ ૦.૦૦ ૨૬,૭૫,૭૫૭.૩૯ ૯૦,૦૫,૫૧,૩૪૮.૦૩ ૮૫,૮૫,૩૧,૧૬૨.૪૫ ૦.૦૦ ૪,૨૦,૨૦,૧૮૫.૫૮ ૦.૦૦	૨,૧૯,૧૬,૨૭,૦૧૫.૦૦ ૧૧,૭૮,૮૮,૫૬,૧૮૭.૫૫ ૦.૦૦
૧૨,૨૫,૫૧,૫૧,૪૦૦.૯૬	સરવાળો આગળ લઈ ગયા		૧૩,૯૮,૦૪,૮૩,૨૦૨.૫૫



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવૈયું

તા. ૩૧-૩-૨૦૨૫ રૂા. પૈસા.	મિલકત અને લેણું	રૂા. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૬ રૂા. પૈસા.
૫,૪૫,૩૫,૦૦,૮૮૩.૨૮ ૭,૦૮,૭૭,૪૨,૨૧૮.૨૧ ૨,૧૮,૬૨,૧૭,૮૩૯.૨૬ ૧,૩૯,૧૮,૧૫૭.૪૭ ૨,૧૪,૪૫,૮૮,૬૪૮.૬૫ ૨,૭૭,૧૧,૦૩૩.૧૪ ૮,૬૧,૨૦,૦૭૫.૧૧ ૬,૭૩,૩૫,૮૧૮.૧૮ ૧,૧૩,૪૯,૨૨,૧૬૪.૨૦ ૦.૦૦ ૧,૧૨,૭૬,૫૧,૧૫૫.૮૦ ૭૨,૭૧,૦૦૮.૩૦ ૧૦,૬૩,૫૧,૬૫૫.૩૪ ૧૦,૫૨,૪૭,૦૦૭.૧૪ ૩,૭૭,૬૬,૦૨,૨૧૪.૭૫ ૦.૦૦ ૩,૭૭,૬૬,૦૨,૨૧૪.૭૫ ૦.૦૦ ૧૮,૦૫,૩૪,૨૦૫.૦૮ ૨૧,૫૭,૭૪,૬૩૧.૮૦	૧. સરવાળો આગળ લાવ્યા... ૬. ધિરાણો ૧. ટુંકી મુદતની લોન / રોકડ શાખ ઓવર ડ્રાફ્ટ અને વટાવેલ બીલો પૈકી (અ) સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે (બ) વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે (ક) જાતજામીનની જામીનગીરી સામે ઉપરના ધિરાણ પૈકી મુદત વીતી રકમ અંદાજે દુબત અને શકમંદ લેણું ૨. મધ્યમ મુદતની લોન પૈકી (અ) સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે (બ) વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે (ક) જાતજામીનની જામીનગીરી સામે ઉપરના ધિરાણ પૈકી મુદત વીતી રકમ અંદાજે દુબત અને શકમંદ લેણું ૩. લાંબી મુદતની લોન પૈકી (અ) સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓના તારણ સામે (બ) અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે (ક) જાતજામીનની જામીનગીરી સામે ઉપરના ધિરાણ પૈકી મુદત વીતી રકમ અંદાજે દુબત અને શકમંદ લેણું 		



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવૈયું

તા. ૩૧-૩-૨૦૨૫ રૂા.	ભંડોળ અને દેવું	રૂા.	પૈસા	તા. ૩૧-૩-૨૦૨૬ રૂા.	પૈસા.
૧૨,૨૫,૫૧,૫૧,૪૦૦.૮૬	સરવાળો આગળ લાવ્યા...			૧૩,૮૮,૦૪,૮૩,૨૦૨.૫૫	
૦.૦૦	૬. બીલ્સ ફોર કલેક્શન (સામી બાજુએ બીલ્સ રીસેવેબલ પ્રમાણે)			૦.૦૦	
૦.૦૦	૭. શાખાના હવાલા			૦.૦૦	
૫૫,૦૮,૭૬૫.૧૮	૮. મુદત વીતેલ વ્યાજ સામે અનામત	૫૫,૦૮,૭૬૫.૧૮			
૧૩૩,૬૫,૫૧,૭૧૭.૧૧	૧. એક્સિડ ઇન્ટરેસ્ટ - સ્યુટ ફાઇલ્ડ (ઓટીએસ-૨૦૧૨)	૧,૫૮,૫૬,૩૭,૩૮૮		૧,૫૮,૫૬,૩૭,૩૮૮	
	૨. ઓવરડ્યુ ઇન્ટરેસ્ટ રીઝર્વ (એન.પી.એ.) કોન્ટ્રા				
૧૮,૨૫,૦૦,૫૧૧.૭	૯. ચુકવવા પાત્ર વ્યાજ			૨૫,૪૪,૧૭,૭૬૮.૩	
	૧૦. અન્ય જવાબદારીઓ				
૫૭,૮૫,૬૭૮.૫૩	૧. ડ્રાફ્ટ પેએબલ	૩,૪૧,૮૮,૭૭૦.૮૧			
૮૨,૦૨,૭૮૩.૦૦	૨. ઉપાડ ન થયેલ ડીવીડન્ડ	૧,૪૮,૬૬,૩૮૫			
૨,૪૧,૩૮,૮૬૬.૦૪	૩. સનડ્રીઝ	૩,૦૩,૪૧,૩૩૭.૮૧			
૦.૦૦	૪. DEAF પેએબલ ટૂ આરબીઆય	૦.૦૦			
૦	૫. સ્ટાફ બોનસ પેએબલ	૦			
૩૭,૪૧,૪૫૭.૦૦	૬. એડજેસ્ટીંગ એકાઉન્ટ (જમા) (ચુકવવાના ખર્ચ)	૩૨,૬૫,૨૦૪			
૦.૦૦	રિઝર્વ ફોર સ્ટાફ લીવ એનકેશમેન્ટ	૦.૦૦			
૧૪,૭૧,૮૦૬.૮૬	૭. સ્ટેલ ચેક અનપેઈડ	૧૧,૭૮,૫૮૩.૮૬			
૪,૨૧,૭૨૫.૦૦	૮. અનકલેઈમ્ડ લાયાબીલીટીઝ	૪,૩૮,૫૪૬			
૧૦,૫૭,૦૦,૦૦૦.૦૦	૯. પ્રોવિઝન ફોર ઇન્કમટેક્સ	૧૦,૭૮,૦૭,૧૮૦.૬			
૩૧,૫૮,૦૭૧.૦૦	૧૦. ડિફર્ડ ટેક્સ લાયાબીલીટી	૨૬,૬૮,૬૦૭			
૧૩,૩૭૨.૨૦	૧૧. એસ.બી.પી.પી. કો-ઓપ બેંક લિ.	૧૩,૩૭૨.૨૦			
૦.૦૦	એમ્પ્લોઈ ગ્રુપ ગ્રેયુઈટી	૦.૦૦			
	૧૨. વેતન સુધારણા				
૨૧,૦૪,૧૩,૭૭૧.૬૩	૧૧. નફો અને નુકસાન				
(૨૧,૦૪,૧૩,૭૭૧.૬૩)	પાછલા વર્ષના સરવૈયા મુજબનો નફો	૦.૦૦			
૨૨,૮૨,૪૮,૪૫૮.૭૪	બાદ: વહેંચણી	૦.૦૦			
	વત્તા: નફા નુકશાન ખાતેથી મેળવેલો ચાલુ સાલનો નફો	૧૬,૩૭,૩૪,૬૬૬.૮૦			
		૧૬,૩૭,૩૪,૬૬૬.૮૦			
૭૧,૧૨,૮૧૬.૦૦	૧૨. આકસ્મિક જવાબદારીઓ				
૦.૦૦	૧. ગ્રાહકો વતી આપેલ ગેરેન્ટીની બાકી રકમ	૧,૮૭,૭૦,૬૦૨.૦૦			
૧૦,૬૬,૭૭,૮૦૭.૮૫	૨. લેટર ઓફ ક્રેડીટની બાકી રકમ	૦.૦૦			
	૩. અધર્સ-ડિપોઝીટ એજ્યુ. એન્ડ એવરનેસ ફંડ-૨૦૧૪	૧૧,૪૪,૮૮,૮૮૩.૬૧			
	કુલ	૧૩,૩૨,૬૮,૫૮૫.૬૧			
૧૪,૧૬,૧૫,૮૭,૭૧૫.૪૦	સરવાળો આગળ લઈ ગયા			૧૬,૧૮,૪૫,૫૨,૭૮૮.૦૦	



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

તા. ૩૧-૩-૨૦૨૫ ના રોજનું સરવૈયું

તા. ૩૧-૩-૨૦૨૪ રૂા.	મિલકત અને લેણું	રૂા.	પૈસા	તા. ૩૧-૩-૨૦૨૫ રૂા.	પૈસા.
૧૨,૫૫,૧૨,૪૩,૧૦૧.૪૯	સરવાળો આગળ લાવ્યા..			૧૪,૨૭,૭૦,૮૬,૯૭૯.૨૭	
૯,૫૪,૯૨,૫૪૬.૦૦	૭. મળવા પાત્ર વ્યાજ				
૧,૩૩,૬૫,૫૧,૭૧૭.૧૧	(અ) રોકાણો ઉપર			૧૧,૩૯,૨૩,૭૫૫.૨	
	(બ) એન.પી.એ. ઉપર (સામે દર્શાવ્યા મુજબ)			૧,૫૮,૫૬,૩૭,૩૮૮	
૦.૦૦	૮. બીલ્સ રીસીવેબલ (સામી બાજુએ બીલ્સ ફોર કલેક્શન પ્રમાણે)			૦.૦૦	
૦.૦૦	૯. શાખાના હવાલા				
૧,૨૩,૮૯,૪૩૪.૬૬	૧૦. ઈમારત	૬,૫૪,૯૫,૫૦૬.૬૬			
	બાદ: ઘસારો	૪,૨૧,૬૯,૨૨૬.૬૬		૨,૩૩,૨૬,૨૮૦.૦૦	
	૧૦ (અ). કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ (બિલ્ડીંગ)				
૧,૧૮,૧૮,૮૧૬.૧૧	૧૧. ફર્નિચર એન્ડ ફીક્ચર	૪,૫૫,૭૩,૨૧૫.૯૯			
	બાદ: ઘસારો	૩,૧૩,૫૫,૧૦૮.૦૨		૧,૪૨,૧૮,૧૦૭.૯૭	
	૧૨. અન્ય અસ્કયામતો				
૧,૬૮,૩૫,૪૦૦.૧૯	૧. સેઈફડી. લોકર્સ, કોમ્પ્યુટર્સ, એટીએમ મશીન વિગેરે	૮,૫૬,૭૬,૪૫૭.૦૦			
	બાદ: ઘસારો	૭,૦૧,૧૪,૪૭૦.૯૬		૧,૫૫,૬૧,૯૮૬.૦૪	
૫૧,૭૫,૦૩૯.૦૦	૨. મોટરકાર અને સ્કુટર	૧૧૮,૩૯,૭૭૭.૦૦			
૨૬,૧૩,૦૪૪.૪૧	બાદ: ઘસારો	૭૫,૩૨,૦૬૯.૦૦		૪૩,૦૭,૭૦૮.૦૦	
૨૯,૫૦,૦૦૦.૦૦	૩. એકાઉન્ટ બુક્સ, સ્ટેશનરી અને સ્ટેમ્પ વિગેરે	૨૭,૬૨,૧૭૭.૦૨			
૮,૦૩,૦૦૦.૦૦	૪. સસ્પેન્સ (ઉધાર)	૨,૫૯,૨૬૦૦૦.૦૦			
૨૧,૭૨,૨૯૫.૯૯	૫. ફેસ્ટીવલ એડવાન્સ ટુ સ્ટાફ	૭,૯૫,૭૦૦.૦૦			
૪,૫૧,૭૫૬.૬૧	૬. લોકલ કલીયરીંગ	૧૮,૧૪,૮૯૪.૯૯			
૦.૦૦	૭. અનકલેઈમ્ડ ડીપોઝીટ - DEAF	૨,૫૫,૯૮૭.૬૮			
૧,૪૬,૧૦૮.૧૨	૮. એડજસ્ટીંગ (ઉધાર) ઈન્કમ રીસીવેબલ	૫,૦૦૦.૦૦			
૨,૮૨,૬૫૭.૫૧	૯. ઈ-સ્ટેપ ઈન્કમ રીસીવેબલ	૯૯,૫૨૧.૧૮			
૧૧,૦૮,૭૯,૪૯૦.૪૪	૧૦. જી.એસ.ટી. (જમા)	૧,૦૧૧.૮૮			
	૧૧. એડવાન્સ ઈન્કમ ટેક્સ એન્ડ	૧૧,૩૪,૫૦,૦૭૮.૧૭			
૦.૦૦	ટીડીએસ રીસીવેબલ (AY ૨૦૨૫-૨૬)				
૦.૦૦	૧૨. એક્સ ગ્રેસીયા લોન વ્યાજ પ્રાપ્ત	૦.૦૦			
૦.૦૦	૧૩. ઈન્કમ ટેક્સ રીફંડ રીસીવેબલ	૦.૦૦			
૦.૦૦	૧૪. ડીફર્ડ ટેક્સ એસેટ	૦.૦૦			
૮૧,૬૦,૨૫૭.૭૬	૧૫. સન્ડ્રી એડવાન્સ	૧૯,૪૭,૧૭૩.૯૬			
૩૬,૩૩,૦૫૦.૦૦	૧૬. સન્ડ્રી ડીપોઝીટ	૩૪,૩૩,૦૫૦.૦૦		૧૫,૦૪,૯૦,૫૯૪.૮૮	
	૧૩. નોન બેંકીંગ મિલ્કત				
	૧૪. નફો અને નુકસાન				૦.૦૦
૧૪,૧૬,૧૫,૯૭,૭૧૫.૪૦				૧૬,૧૮,૪૫,૫૨,૭૯૯.૦૦	

શ્રી જીતેન્દ્રકુમાર કાંતિલાલ દેસાઈ : ચેરમેન
શ્રી ભરત કીશુભાઈ પટેલ : વાઈસ ચેરમેન

ડૉ. સિદ્ધાર્થ ટી. શુક્લા : મેનેજિંગ ડીરેક્ટર
શ્રી નિલય બી. દેસાઈ : આસી. જનરલ મેનેજર
શ્રીમતિ જ્યોતિ એસ. દેસાઈ : આસી. જનરલ મેનેજર
શ્રીમતિ જાગૃતિ ડી. શાહ : ચીફ એકાઉન્ટન્ટ

મુખ્ય એકાઉન્ટિંગ પોલીસીઓ તથા
એકાઉન્ટ અંગેની નોટ્સ તથા
અમારા રીપોર્ટ સામેલ કર્યા મુજબ

સ્થળ: કિલ્લા પારડી
તારીખ: ૨૭/૦૫/૨૦૨૫

અન્વેષકનું નામ : શ્રી સ્મેશ એન્ડ કંપની
હોદ્દો : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
પેનલ નંબર : UCN 1002965



તા. ૧-૪-૨૦૨૫ થી તા. ૩૧-૩-૨૦૨૬ ના સમય માટેનું નફા તોટા ખાતુ

[illegible]



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

તા. ૧-૪-૨૦૨૫ થી તા. ૩૧-૩-૨૦૨૬ ના સમય માટેનું નફા તોટા ખાતું

તા. ૩૧-૩-૨૦૨૫ રૂા. પૈસા.	આવક	રૂા. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૬ રૂા. પૈસા.
૬૧,૧૪,૦૩,૨૮૮.૭૭ ૨૦,૦૬,૬૮,૭૪૨.૩૭ ૬,૮૮,૬૨,૩૪૫.૦૦ ૧૫,૩૦,૩૨૬.૨૩ ૨૪,૬૮,૧૨૩.૧૯ ૨,૪૯,૩૩૯.૪૮ ૩૧,૫૬૨.૦૦ ૨૪,૮૧૫.૯૩ ૦.૦૦ ૭,૬૮,૩૩૯.૭૩ ૩,૧૬,૬૨,૫૦૯.૪૯ ૦ ૧,૩૮,૧૭,૮૬૮.૮૩ ૦.૦૦ ૮,૨૩,૪૩૪.૧૦ ૧૧,૫૨૦.૦૦ ૭૯,૩૧,૯૭૮.૮૮ ૦.૦૦ ૧૨,૪૬૮.૦૦ ૦.૦૦ ૧,૫૪,૦૦૦.૦૦ ૧,૨૭૪.૦૦ ૪૬,૨૦૦.૦૦ ૯,૫૩,૯૦૭.૦૦ ૧,૭૯,૫૪૩.૬૧ ૨૦,૦૦૦.૦૦ ૭૮,૫૩,૭૧૦.૦૦ ૧,૦૦,૦૦,૦૦૦.૦૦ ૧,૦૮,૦૦૦.૦૦ ૧૪,૧૫,૭૫૩.૦૩ ૨,૬૭,૫૩૪.૦૦ ૪૮,૪૦૦.૦૦ ૧૦,૬૦૦.૦૦ ૧,૫૬,૪૩૮.૬૮ ૧૯,૭૦,૩૭૮.૯૦ ૨૮,૮૦૦.૦૦ ૫,૪૨,૫૪૪.૧૦ ૩,૧૬,૫૧૩.૦૦ ૨૦,૦૦૦.૦૦ ૦.૦૦ ૪,૬૧,૦૭૯.૩૫ ૨૧,૭૩,૭૪૩.૩૩ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦	૧. અ. લોન અને એડવાન્સ પર વ્યાજ અને ડીસ્કાઉન્ટ બ. રોકાણો પર વ્યાજ અને ડીસ્કાઉન્ટ ક. બેંક થાપણ પર વ્યાજ ૨. કમીશન, વટાવ અને દલાલી કમીશન - ECOM POS/IMPS/ATM-NET કમીશન - ઈસ્ટેમ્ કમીશન - ગુજરાત ગેસ બીલ કલેક્શન કમીશન - જનરલ ઈન્સ્યોરન્સ એન્ડ લાઈફ ઈન્સ્યો. ૩. સહાય અને દાન ૪. અ. પ્રોફીટ ઓન સેલ્સ ઓફ એસેટ (નેટ) બ. પ્રોફીટ ઓન સેલ્સ ઓફ ઈન્વેસ્ટમેન્ટ (નેટ) ૫. અન્ય આવક મકાન ભાડુ સેઈફ ડીપોઝીટ લોકર્સ ભાડુ લોન એપ્લીકેશન ફી ઓવરડ્રાફ્ટ રીન્યુઅલ ફી કેશ ડીપોઝીટ ચાર્જીસ લોન પ્રોસેસીંગ ફી HUDCO કલેઈમ પ્રોસેસીંગ ફી ગોલ્ડ કસ્ટડી ચાર્જ આત્મનિર્ભર પ્રોત્સાહન યોજના MMUY લોન બેંક/રીકવરી Mgmnt ઈન્સેન્ટીવ શેર ટ્રાન્સફર ફી નોમીનેશન ફી કેશ હેન્ડલીંગ ચાર્જીસ પરચુરણ આવક ટેન્ડર ફી રીસીલ્ડ ઈન્કમ ટેક્સ રીફન્ડ રીવર્સલ ઓફ એક્સેસ પ્રોવિઝન સીક્યુરીટી ડીપોઝીટ પર વ્યાજ ATM કાર્ડ / SHM કાર્ડ ચાર્જ રીકવરી એટીએમ ટ્રાન્ઝેક્શન ફી વ્હીકલ પેપર લેટ ફી ખાતા બંધ ચાર્જીસ લોન એડવાન્સ સ્વિચઓવર ચાર્જ આદેશ શુલ્ક પાસબુક ઈશ્યુ ચાર્જીસ ચેકબુક ઈશ્યુ ચાર્જીસ ક્વાટરલી કમિટમેન્ટ ચાર્જીસ સ્ટોપ પેમેન્ટ ચાર્જીસ ચેક રીટર્ન ચાર્જીસ SMS ચાર્જીસ સ્ટેશનરી એન્ડ પ્રિન્ટીંગ ચાર્જ - રીકવર્ડ કોર્ટના આદેશ મુજબ દંડની આવક એક્સેસ પ્રોવિઝન ફોર એમએમસીબી રીટર્ન બેંક એક્સેસ પ્રોવિઝન ફોર આયડીઆર રીટર્ન બેંક ૬. ખોટ	૬૪,૨૪,૩૦,૨૮૭.૭૨ ૨૨,૫૭,૩૧,૯૨૨.૩૪ ૮,૨૮,૯૩,૭૨૪ ૧૮,૪૯,૨૧૬.૦૦ ૨૧,૯૮,૩૨૫.૮૬ ૩,૮૩,૧૫૭.૭૬ ૭૦,૫૯૭.૬ ૪,૭૧,૮૭૭.૦૦ ૦.૦૦ ૪,૨૬,૧૪,૦૨૫.૦૪ ૧,૫૭,૪૩,૯૬૯.૩૭ ૦.૦૦ ૨૨,૦૬,૧૫૪.૭૭ ૯,૧૩૦ ૧,૩૨,૫૧,૮૮૮.૧૧ ૦.૦૦ ૪,૦૨૬ ૦.૦૦ ૦.૦૦ ૨૩૨ ૫૫,૫૦૦ ૧૬,૬૭,૦૬૨ ૨,૦૪,૪૩૪.૬૧ ૧૨,૨૦૦ ૦.૦૦ ૭૦,૦૦,૦૦૦.૦૦ ૬૭,૬૨૬ ૧૪,૩૦,૧૩૩.૩૩ ૨,૯૪,૮૩૪ ૧૬,૪૦૦ ૬,૭૦૦ ૫૪,૯૬૦.૪ ૧૯,૯૮,૮૦૮.૫ ૩૨,૮૮૨ ૨,૯૫,૬૨૯.૩ ૨,૯૨,૧૫૨ ૧૯,૬૦૦ ૦.૦૦ ૪,૬૮,૯૮૪.૭૫ ૩૪,૮૯,૭૪૫.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦	૯૫,૧૦,૫૫,૯૩૪.૦૬ ૦.૦૦ ૪૯,૭૩,૧૭૪.૨૨ ૪,૨૬,૧૪,૦૨૫.૦૪ ૪,૮૬,૨૩,૦૬૨.૧૪ ૦.૦૦

૯૬,૬૯,૯૫,૧૮૧.૦૦			૧૦૪૭૨૬૬૧૯૫.૪૬
-----------------	--	--	---------------

શ્રી જીતેન્દ્રકુમાર કાંતિલાલ દેસાઈ : ચેરમેન
શ્રી ભરત કીકુભાઈ પટેલ : વાઈસ ચેરમેન
ડૉ. સિદ્ધાર્થ ટી. શુક્લા : મેનેજિંગ ડીરેક્ટર
શ્રી નિલય બી. દેસાઈ : આસી. જનરલ મેનેજર
શ્રીમતિ જ્યોતિ એસ. દેસાઈ : આસી. જનરલ મેનેજર
શ્રીમતિ જાગૃતિ ડી. શાહ : ચીફ એકાઉન્ટન્ટ
મુખ્ય એકાઉન્ટીંગ પોલીસીઓ તથા
એકાઉન્ટ અંગેની નોટ્સ તથા
અમારા રીપોર્ટ સામેલ કર્યા મુજબ
અન્વેષકનું નામ : શ્રી સ્પેશ એન્ડ કંપની
હોદ્દો : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
પેનલ નંબર : UCN 1002965

સ્થળ: કિલ્લા પારડી
તારીખ: ૨૭/૦૫/૨૦૨૫



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



ગુજરાતી સહકારી બેંક લિમિટેડ (શિક્ષક બેંક)

SCHEDULE : 1

Significant Accounting Policies

1. General :

- 1.1 The accompanying financial statements have been prepared on the historical cost basis, in accordance with normally accepted accounting principles on going concern basis and confirm to the statutory provisions and practices prevailing within the co-operative banking industry in the country.
- 1.2 The Revenue nature income and expenses are being accounted for on accrual basis.
- 1.3 As per **AS 5 Prior Period Items**, if any are shown in Notes on Accounts w.r.t. any item of prior period income or prior period expenditure which exceeds one per cent of the total income/total expenditure of the bank if the income/expenditure is reckoned on a gross basis or one per cent of the net profit before taxes or net losses as the case may be if the income is reckoned net of costs.

2. Investments :

Investments are categorized, classified and valued in accordance with Reserve Bank of India's guidelines .

2.1 Classification of investments :

The investments are classified under the following three categories:

- (i) **Held to Maturity** : Securities acquired by the bank with the intention to hold them till maturity.
- (ii) **"Held for Trading** : Securities acquired by the bank with the intention to trade by taking advantage of the short term price / interest rate movements. Bank does not have any securities under HFT category. "
- (iii) **Available for sale** : Securities which do not fall within the above two categories .The same are available for sale at anytime of the year.

2.2 Valuation of Investment :

- (i) **Held to Maturity** : Investments under this category are not marked to market and carried at acquisition cost. If acquired at premium over the face value, the premium is amortized over the remaining period till maturity on straight line basis and such amortization of premium is transferred to "Amortization of Investment Premium Paid" in Profit & Loss Account. Amortization has been booked under profit and loss account.
- (ii) **Held for Trading and Available for Sale** : Individual script in this category are marked to market and valued on the rates put out by FBIL and net depreciation in each group for each category is provided and recognised in Profit & Loss account and net appreciation, if any, is ignored. On provision for depreciation, the book value of the individual securities remains unchanged after marking to market. In the current year, IDR provision has been booked under profit and loss account.
- (iii) Treasury Bills under all categories/classifications are valued at carrying cost. Mutual Fund Instruments are valued at market rate or repurchase price or net asset value in that order depending on their availability.

3. Advances :

All Advances are classified as per RBI guidelines into Standard, Sub-standard, Doubtful and Loss Assets. Provisioning for Non Performing Assets in all these categories as well as Performing Assets have been made in accordance with prudential norms prescribed by RBI from time to time.

4. Fixed Assets:

- (a) Premises and other fixed assets (including furniture & fixtures) have been accounted for at historical cost or construction less accumulated depreciation
- (b) Premises include free hold properties.
- (c) Depreciation is provided on written down value method except the computers and not at the rate prescribed under the Income Tax Rules, 1961. As per RBI guidelines, depreciation on Computers is provided at 33.33% on straight line method.
No Depreciation is provided on the assets in the year of Sale / disposal. Depreciation on fixed asset purchased during the year is charged for the entire year if the assets are purchased and retained for 180 days or more. Otherwise it is charged at 50% of the normal rate

(d) Rates of Depreciation are as under :

Sr. No	ASSETS	RATE%	METHOD
1	LAND & BUILDING	10	WDV
2	FURNITURE & FIXTURE / DEAD STOCK	10	WDV
3	ELECTRIC FITTINGS	15	WDV
4	SAFE DEPOSIT LOCKERS	10	WDV
5	MACHINERY / OFFICE EQUIPMENTS	25	WDV
6	COMPUTERS	33.33	SLM
7	MOTOR CAR / SCOOTER	20	WDV
8	ROOFTOP SOLAR	40	WDV



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિડયુલ્સ બેંક)

(e) Impairment of Assets (AS 28) :

A substantial portion of the bank's assets comprise of “**Financial Assets**” to which Accounting Standard 28 on Impairment of assets issued by The Institute of Chartered Accountants of India, is not applicable. In the opinion of the bank the fixed assets possessed by the bank are in the nature of “Corporate Assets” and are not Cash Generating Unit as defined by the said Accounting Standard and there is no impairment of any of the fixed assets

5. Revenue Recognition (AS 9) :

(a) Income:

Interest and other income are recognized on accrual basis except following which are recognized on realization basis:

- Interest and other income on Non Performing Assets is recognized as per RBI guidelines.
- Guarantee Commission and Income from ATM operations.
- Dividend on Investment in shares of co-op. Institution.
- Income on units of Debt and Money Market Mutual Fund
- Locker rent

(b) Expenditure:

- Revenue expenditure is accounted properly in accordance with normally accepted accounting principles.
- Interest on overdue Term Deposits is provided at the rate of interest applicable to Savings Bank Deposits as per RBI guidelines.

OR

Interest on overdue Term Deposits is provided at the rate of interest applicable to Savings Bank Deposits or the contracted rate of interest on the matured TD, whichever is lower as per RBI guidelines.

- The Insurance Expenses is accounted for on cash Basis.

6. Employee Benefits:

Defined Contribution Plans

Provident Fund : Banks contribution paid/payable during the year to Employees Provident Fund are recognized in the Profit & Loss account.

Defined Benefit Plans

Gratuity : Gratuity liability is defined benefit obligation and is provided for on the basis of an actuarial valuation determined by LIC of India by paying premium under Group Gratuity Scheme. The Premium Contribution has been charged to Profit & Loss Account.

Leave Encashment : Leave Encashment liability is defined benefit obligation and is provided for on the basis of an actuarial valuation determined by LIC of India by paying premium under New Group Leave Encashment Scheme Policy. The Premium Contribution has been charged to Profit & Loss Account.

7. Accounting for Taxes on Income :

- Tax expense comprises both deferred and current taxes. Current year tax is determined as the amount of tax payable in respect of taxable income for the year. Deferred tax is recognized on timing difference between the accounting income and tax income that originate in one period and are capable of reversal in one or more subsequent periods.
- Deferred Tax is based on tax rates and the tax laws effective at the Balance Sheet date.
- Deferred Tax Assets are recognized only to the extent that there is reasonable certainty that sufficient future taxable income will be available against which such Deferred Tax Assets can be realized.

8. Segment Reporting (AS 17) :

Except the banking segment, the bank does not have any other operational segment. The risk and returns of the bank are affected predominantly by banking operations only which can be classified as primary segment. The result of the segment is self explanatory from the Balance Sheet and Profit and Loss statement.

9. Related Parties and Disclosures (AS 18) :

The bank is a cooperative society registered under The Gujarat State Cooperative Society Act 1961. There are no related parties requiring a disclosure under accounting standard 18 (AS 18) issued by The Institute of Chartered Accountants of India (ICAI), other than one Key Management Personnel viz Mr. Siddharth T Shukla, Managing Director. However, In terms of RBI circular dated March 29, 2003, he being single party coming under the category, no further details thereon need to be disclosed.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષક બેંક)

10. Lease Rents (AS 19):

1. The rent payment of Rs.43.07 lacs for 4 branches has been recognised in the statement of Profit and Loss for the year ended March,2026.
2. The rent agreements entered into pertain to use of premises at the branch. These agreements do not have any undue restrictive or onerous clauses other than those normally prevalent in similar agreement regarding use of assets.

11. Earning per Share (AS 20)

Basic earning per share is calculated by dividing the net profit or loss (after Tax) for the period by the average number of shares outstanding during the year. The average number of shares is calculated on fortnightly basis.

OR

Basic earning per share is calculated by dividing the net profit or loss (after Tax) for the period by the average number of shares outstanding during the year. The average number of shares is reckoned from average of share capital as reported to Reserve Bank of India in Form IX for UCBs during the 12 months of the financial year

12. Discontinuing operations (AS 24)

There are no discontinuing operations as per w.r.t.AS 24

SCHEDULE : 2

Notes on Accounts

1 Previous year's figures

Previous year's figures have been regrouped / rearranged and reclassified wherever necessary.

2 Inter Branch Transactions

All the Inter Branch-Head office transactions are entered and responded on an ongoing basis in CBS.

Inter Bank Transactions

Accounts with other Banks have been tallied up to 31st March 2026. Elimination of outstanding entries is in progress

3 Provisions for Advances :

The Bank has made provision for NPA Accounts in accordance with Statutory requirements of R.B.I.

N.P.A. provision required is Rs. 3572.93 Lakh against which the bank has held total provision of Rs. 4341.25 Lakh including OIR Suit Filed. Hence there is Excess provision of Rs. 768.32 lakh.

The Bank has also provided Rs. 278.00 lakh towards Provision against Standard Assets.

31.03.2026

NPA Provisions	No of Accounts	Amount Outstanding	Provision Required	Provision Held
Sub-standard Assets	21	290.97	29.76	29.76
Doubtful up to 1 year	16	134.14	28.32	28.32
Doubtful 1 to 3 years	14	169.57	51.44	51.44
Doubtful above 3 years	205	2189.54	2189.54	2189.54
Loss Assets	205	1273.87	1273.87	1273.87
TOTAL	461	4058.09	3572.93	3572.93
Extra Provision held over requirement				768.32
Total Provision held for NPA Accounts				4341.25
Provision Coverage Ratio				106.98%

31.03.2025

NPA Provisions	No of Accounts	Amount Outstanding	Provision Required	Provision Held
Sub-standard Assets	21	179.78	20.08	20.08
Doubtful up to 1 year	16	200.33	40.78	47.78
Doubtful 1 to 3 years	6	57.99	17.80	17.80
Doubtful above 3 years	201	2171.03	2171.03	2171.03
Loss Assets	206	1274.43	1274.43	1274.73
TOTAL	450	3883.56	3524.12	3524.12
Extra Provision held over requirement				817.13
Total Provision held for NPA Accounts				4341.25
Provision Coverage Ratio				111.79%



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

4 Employee Benefits (AS 15)

Gratuity Report Under AS-15 for year ended	31.03.2026	31.03.2025
Changes in present value of Obligation	Rs. In lakhs	Rs. In lakhs
Present value of obligations as at beginning of year	1252.24	1185.40
New Policy at the End of Previous Year	0.00	0.00
Interest cost	90.77	85.99
Current Service Cost	75.07	64.00
Benefits Paid	106.80	143.69
Actuarial (gain)/ loss on obligations	(80.70)	58.33
Present value of obligations as at end of year	1230.61	70.36
Changes in the fair value of plan assets		
Fair value of plan assets at beginning of year	1446.27	147.12
New Policy at the End of Previous Year	0.00	0.00
Expected return on plan assets	105.92	178.00
Contributions	31.55	603.98
Benefits Paid	106.80	143.69
Actuarial gain/(loss) on Plan assets	0.00	0.00
Fair value of plan assets at the end of year	1476.97	2109.67
The amounts to be recognized in the balance sheet		
Present value of obligations as at the end of year	1230.61	70.36
Fair value of plan assets as at the end of the year	1476.97	2109.67
Funded status	246.36	2039.31
Net asset/(liability) recognized in balance sheet	246.36	2039.31
Expenses Recognised in statement of Profit and loss		
Current Service cost	75.07	64.00
Interest Cost	90.77	85.99
Expected return on plan assets	(105.92)	(178.00)
Net Actuarial (gain)/ loss recognized in the year	(80.70)	58.33
Expenses recognised in statement of Profit and loss	(20.78)	30.32

Category of Plan Assets :

The banks plan assets in respect of Gratuity is funded through the Group Scheme of Life Insurance Corporation of India.

Assumptions :

Discount Rate	7.25%	7.25%
Salary Escalation	7.00%	7.00%
Expected Retirement age of employees	58 years	58 years
Mortality Rate	LIC (2006-08) ultimate	LIC (2006-08) ultimate



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

NGLES Report Under AS-15 for year ended	31.03.2026	31.03.2025
Changes in present value of Obligation	Rs. In lakhs	Rs. In lakhs
Present value of obligations as at beginning of year	5796.56	1185.40
Interest cost	420.25	85.99
Current Service Cost	93.22	64.00
Benefits Paid	(69.75)	143.69
Actuarial (gain)/ loss on obligations	(5670.65)	58.33
Present value of obligations as at end of year	569.63	1537.41
Changes in the fair value of plan assets		
Fair value of plan assets at beginning of year of Policy	681.11	1109.00
Merged		76.40
Expected return on plan assets	50.75	178.00
Contributions	66.62	603.98
Benefits Paid	(69.75)	143.69
Actuarial gain/(loss) on Plan assets	0.00	0.00
Fair value of plan assets at the end of year	728.73	2111.07
The amounts to be recognized in the balance sheet		
Present value of obligations as at the end of year	569.63	1537.41
Fair value of plan assets as at the end of the year	728.73	2111.07
Funded status	159.11	869.77
Net asset/(liability) recognized in balance sheet	159.11	869.77
Expenses Recognised in statement of Profit and loss		
Current Service cost	93.22	74.00
Interest Cost	420.25	85.99
Expected return on plan assets	(50.75)	(178.00)
Net Actuarial (gain)/ loss recognized in the year	(5670.65)	58.33
Expenses recognised in statement of Profit and loss	(5207.93)	5.80

Category of Plan Assets :

The banks plan assets in respect of Leave Encashment is funded through the New Group Leave Encashment Scheme of Life Insurance Corporation of India.

Assumptions :

Discount Rate	7.25%	7.25%
Salary Escalation	7.00%	7.00%
Expected Retirement age of employees	58 years	58 years
Mortality Rate	LIC (2006-08) ultimate	LIC (2006-08) ultimate



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

5. Break up of Deferred Tax :

as at 31.03.2026

Particulars	As at 31st March, 2026		As at 31st March, 2025	
	Deferred Tax Asset	Deferred Tax Liability	Deferred Tax Asset	Deferred Tax Liability
Difference between book depreciation and tax depreciation	300201		789665	
Special Reserve u/s. 36 (1) (viii) of Income Tax Act, 1961		2368406		2368406
Unpaid liability allowable on payment basis U/s. 43B of Income Tax Act, 1961				
Total	300201	2368406	789665	2368406
Net Deferred Tax Liability/(Asset)	2668607		3158071	
CURRENT YEAR EFFECT -DTL	(489464)			

as at 31.03.2025

Particulars	As at 31st March, 2025		As at 31st March, 2024	
	Deferred Tax Asset	Deferred Tax Liability	Deferred Tax Asset	Deferred Tax Liability
Difference between book depreciation and tax depreciation	789665		-772946	
Special Reserve u/s. 36 (1) (viii) of Income Tax Act, 1961		2368406		2368406
Unpaid liability allowable on payment basis U/s. 43B of Income Tax Act, 1961				
Total	789665	2368406	-772946	2368406
Net Deferred Tax Liability/(Asset)	3158071		1595460	
CURRENT YEAR EFFECT -DTL	1562611			

The application of Deferred Tax has resulted in a net credit of Rs. 4,89,464/- to the Profit and Loss Account for the year ended 31st March, 2026.

6 Earning per Share (AS 20)

31.03.2026

31.03.2025

Net Profit after Tax during the year Rs. In Lacs	1637.35	2282.49
Average No. of Equity Shares outstanding in Lacs	15.99	16.06
Nominal Value of equity Shares Rs.	100.00	100.00
Basic Earnings and Diluted Earnings per Share	102.43	142.12

7 Due to **MTM Loss** of AFS category Investment, total IDR require derives at Rs. 9,56,18,870.74 against held IDR Rs. 59,87,738.74. The bank has made a provision to Rs.8,96,31,132.00 as on 31.03.2026 and provided for the same in profit and loss account.

8 Amortisation of Premium paid on Government Securities:

As on 31-03-2025, The Bank holds Government Securities under HTM category which is purchased on premium and hence there is Rs.1,83,127/- debited to Profit & Loss Account due to amortization of premium paid on Government securities.

9 As on Balance Sheet date the bank has held shares of Rs.5000/- of GUJARAT STATE FINANCIAL CORPORATION and RS.500/- GUJARAT STATE CO.OP.HOUSING FINANCE SOC. LTD. A'BAD., which is classified as NPA due to no dividend. The bank has held full provision under "**Investment Depreciation Reserve.**"



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

10 As on Balance Sheet date the bank has held full provision of Rs. **28.35** crore under Contingency Reserve Fund against FDR of Rs. **28.35** crore with Madhavpura Mercantile Coop Bank Ltd. And Rs. **0.06** crore provision under Reserve For Depletion in Asset Value against FDR of Rs. **0.06** crore with Natpur Coop Bank Ltd. On receipt of **0.7** Crores, the excess provision of Rs. **0.7 Crores** has been reversed and credited to profit and loss account.

11 Net Profit or Loss for the period, Prior Period Items and Changes in Accounting Policies (Accounting Standard -5)

(i) Prior Period Items: During the year, there were no material prior period income / expenditure items.

(ii) Change in accounting policy: The Bank has continued to follow the same accounting policies and practices in preparation of Audited financial statements for the current year, as followed in the previous financial year.

OR

11 Prior Period Items and Changes in Accounting Policies (AS 5): (i) Prior Period Items: NIL

(ii) Change in accounting policy: The Bank has continued to follow the same accounting policies and practices in preparation of Audited financial statements for the current year, as followed in the previous financial year.

12 The proposed allocation of Net Profit w.r.t. F.Y.2025-26 is decided vide Board Resolution no.2/4 dated 07-04-2026, which is in tune with the provisions of Gujarat State Co-operative Societies Act and RBI norms. The bank is advised to distribute the profit as per the Board resolution.

PARTICULARS	Rs.
RESERVE FUND - u/s 67 GCS ACT	4,09,33,667.00
BAD DEBT RESERVE - u/s 67A GCS Act	2,45,60,200.00
DIVIDEND - u/s 68 GCS ACT	3,18,20,298.00
EDUCATION CONTRIBUTION - u/s 69 OF GCS ACT	3,00,000.00
SHARE HOLDER BENEFIT FUND - U/S 70A GCS ACT	20,00,000.00
IFR	6,00,00,000.00
CELEBRATION OF 100 YEARS - FOR SHARE HOLDER BENEFIT	10,00,000.00
CYBER SECURITY FUND	10,00,000.00
RESERVE FUND	21,20,501.88
TOTAL	16,37,34,666.88

13 Commission received from Referral Arrangements :

COMMISSION INCOME	45.08 lakh
PMJJBY	0.08 lakh
PMSBY	0.00 lakh

Commission received from Bills Collection Arrangements :

GUJARAT GAS LTD.	0.7 lakh
Commission received from Estamping	3.83 lakh

14 OTS Scheme 2012 declared by Gujarat Government (up to 12-09-19) Status as on 31-03-2026 :

Rs. In Lacs

From Beginning of scheme	Total A/CS involved	Amount involved	Total Recovery	Outstanding Accounts	Outstanding Balance
	1086	2504.15	2485.17	8	18.98

The Board of Directors has resolved in the Board meeting dated 29-05-2020 vide Resolution no. 2/19 to reinstate 40 accounts amounting to Rs 69.63 lacs due to failure of repayment as per OTS scheme. Total reinstated amount of 40 accounts arrives at Rs 311.26 lacs including



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

તા. ૩૧-૩-૨૦૨૫ થી તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજના રીઝર્વ તથા ફંડોની વિગત દર્શાવતું પત્રક

અ. નં.	વિગત	તા. ૩૧-૩-૨૦૨૫ ના રોજનું ફંડ રા.	૨૦૨૪-૨૦૨૫ ના નફામાંથી લીધેલી રકમ	બીજી જમા લીધેલી રકમ	ચાલુ વર્ષના નફા-તોટા ખાતેથી લાધ્યા	વર્ષ દરમિયાન ચુકવેલ રકમ	તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું ફંડ
૧	રીઝર્વ ફંડ	૬૪,૬૬,૭૨,૪૭૦.૨૬	૬,૩૩,૩૦,૦૧૫.૭૪	૨૧,૨૨,૬૫,૩૭૪.૫૯	૦.૦૦	૦.૦૦	૯૨,૨૨,૬૭,૮૬૦.૫૯
૨	ઈમારત ફંડ	૮,૦૦,૦૦,૦૦૦.૦૦	૫,૦૦,૦૦,૦૦૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૧૩,૦૦,૦૦,૦૦૦.૦૦
૩	ડુબલ અને શક્ય લેણા સામે રીઝર્વ	૪૨,૮૬,૧૫,૨૯૮.૮૨	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૪૨,૮૬,૧૫,૨૯૮.૮૨
૪	રોકાણોના ઘસારા સામે રીઝર્વ	૫૯,૮૭,૭૩૮.૭૪	૦.૦૦	૮,૬૬,૩૧,૧૩૨.૦૦	૦.૦૦	૦.૦૦	૬,૫૬,૧૮,૮૭૦.૭૪
૫	અન્ય ફંડો						
૧.	ધર્મદા ફંડ	૨,૦૦,૪૩૨.૮૨	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૨,૦૦,૪૩૨.૮૨
૨.	સામાજિક કલ્યાણ ફંડ	૧૩,૪૪,૬૩૮.૫૮	૬૦,૦૦,૦૦૦.૦૦	૦.૦૦	૦.૦૦	૨૯,૭૨,૮૩૦.૦૦	૪૩,૭૬,૮૦૮.૫૮
૩.	કન્ટીન્યુઅલી પ્રોવિઝન ઓફ સ્ટાન્ડર્ડ એસેટ	૨,૭૮,૦૦,૦૦૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૨,૭૮,૦૦,૦૦૦.૦૦
૪.	કન્ટીન્યુઅલી રીઝર્વ ફંડ	૨૯,૦૪,૮૦,૫૫૭.૯૨	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૭૦,૦૦,૦૦૦.૦૦	૨૯,૭૪,૮૦,૫૫૭.૯૨
૫.	અસ્થાયીમતોના ઘટાડા સામેનું રીઝર્વ	૧૯,૨૦,૦૮૨.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૧૯,૨૦,૦૮૨.૦૦
૬.	રોકાણોના વધ-ઘટ સામેનું રીઝર્વ	૧૧,૯૯,૪૧,૨૬૦.૫૩	૪,૦૦,૦૦,૦૦૦.૦૦	૦.૦૦	૦.૦૦	૬,૮૬,૭૭,૭૪૩.૦૦	૯,૧૨,૬૩,૫૧૭.૫૩
૭.	લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ રીઝર્વ	૯૪,૧૦,૩૮૬.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૯૪,૧૦,૩૮૬.૦૦
૮.	સાથબર સીક્યુરીટી	૧૦,૦૦,૦૦૦.૦૦	૧૦,૦૦,૦૦૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૨૦,૦૦,૦૦૦.૦૦
	ટોટલ	૧,૮૨,૦૯,૬૫,૪૬૩.૨૬	૧૬,૦૩,૩૦,૦૧૫.૭૪	૩૦,૧૯,૨૬,૫૦૬.૫૯	૦.૦૦	૭,૮૬,૫૦,૫૭૩.૦૦	૨,૨૦,૪૫,૭૧,૪૧૨.૫૯

૧	ઈંડ	૧૦,૦૦૦.૦૦
૨	નોમીનલ મેમ્બર ફી	૧૨,૫૨,૪૦૦.૦૦
૩	એડમીશન ફી	૨,૪૦,૮૦૦.૦૦
		૧૫,૦૩,૨૦૦.૦૦



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

Accounting Standard 17 – Segment Reporting Format

Part A: Business segments

(Amount in ₹ crore)

Business Segments	Treasury		Corporate/Wholesale Banking		Retail Banking		Other Banking Business		Total	
Particulars	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
Revenue	35.13	30.12	0.00	0.00	64.24	61.65	5.36	4.93	104.73	96.70
Result	35.13	30.12	0.00	0.00	-17.05	-8.79	5.36	4.93	23.44	26.26
Unallocated expenses										
Operating profit	2.05								23.44	26.26
Provisions & contingencies	5.02	-2.83							2.05	-2.83
Income taxes		6.27							5.02	6.27
Extraordinary profit / loss									0.00	0.00
Net profit									16.37	22.82
Other information:										
Segment assets	586.35	450.21			1032.11	965.95			1618.46	1416.16
Unallocated assets										
Total assets									1618.46	1416.16
Segment liabilities										
Unallocated liabilities									1618.46	1416.16
Total liabilities									1618.46	1416.16

Part B: Geographic segments

(Amount in ₹ crore)

Business Segments	Domestic		International		Total	
Particulars	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
(a) Revenue	23.44	26.26	0.00	0.00	23.44	26.26
(b) Assets	1618.46	1416.16	0.00	0.00	1618.46	1416.16

Note: No disclosure need be made in the shaded portion

Note:

- The business segment shall ordinarily be considered as the primary reporting format and geographical segment would be the secondary reporting format.
- The business segments will be 'Treasury', 'Corporate / Wholesale Banking', 'Retail Banking' and 'Other banking operations'.
- 'Domestic' and 'International' segments will be the geographic segments for disclosure.
- Banks shall adopt their own methods, on a reasonable and consistent basis, for allocation of expenditure among the segments.
- 'Treasury' shall include the entire investment portfolio.
- Retail Banking shall include exposures which fulfil the four criteria of orientation, product, granularity, and low value of individual exposures for retail exposures laid down in Master Directions on Basel III: Capital Regulations (modified from time to time). Individual housing loans will also form part of Retail Banking segment for the purpose of reporting under AS-17.
- Corporate / Wholesale Banking includes all advances to trusts, partnership firms, companies, and statutory bodies, which are not included under 'Retail Banking'.
- Other Banking Business includes all other banking operations not covered under 'Treasury', 'Wholesale Banking' and 'Retail Banking' segments. It shall also include all other residual operations such as para banking transactions/activities.
- Besides the above-mentioned segments, banks shall report additional segments within "Other Banking Business" which meet the quantitative criterion prescribed in the AS 17 for identifying reportable segments.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

Related Party Disclosures

(Amount in ₹ crore)

Items/Related Party	Parent (as per ownership or control)	Subsidiaries	Associates/ Joint ventures	Key Management Personnel @	Relatives of Key Management Personnel	Total
Borrowings	0	0	0	0	0.05	0.05
Deposits	0	0	0	0	0	0
Placement of deposits	0	0	0	0	0	0
Advances	0	0	0	0	0	0
Investments	0	0	0	0	0	0
Non-funded commitments	0	0	0	0	0	0
Leasing/HP arrangements availed	0	0	0	0	0	0
Leasing/HP arrangements provided	0	0	0	0	0	0
Purchase of fixed assets	0	0	0	0	0	0
Sale of fixed assets	0	0	0	0	0	0
Interest paid	0	0	0	0	0	0
Interest received	0	0	0	0	0	0
Rendering of services*	0	0	0	0	0	0
Receiving of services*	0	0	0	0	0	0
Management contracts*	0	0	0	0	0	0



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

Annexure III Disclosure in financial statements – ‘Notes to Accounts’

1. Regulatory Capital

a) Composition of Regulatory Capital

(Amount in ₹ crore)

Sr. No.	Particulars	Current Year	Previous Year
i)	Common Equity Tier 1 capital (CET 1)* / Paid up share capital and reserves@ (net of deductions, if any)	128.85	133.26
ii)	Additional Tier 1 capital*/ Other Tier 1 capital@		
iii)	Tier 1 capital (i + ii)	128.85	125.15
iv)	Tier 2 capital	23.91	24.05
v)	Total capital (Tier 1+Tier 2)	152.76	153.31
vi)	Total Risk Weighted Assets (RWAs)	703.09	644.8
vii)	CET 1 Ratio (CET 1 as a percentage of RWAs)* / Paid-up share capital and reserves as percentage of RWAs@	18.33%	19.41%
viii)	Tier 1 Ratio (Tier 1 capital as a percentage of RWAs)	18.33%	19.41%
ix)	Tier 2 Ratio (Tier 2 capital as a percentage of RWAs)	3.40%	3.11%
x)	Capital to Risk Weighted Assets Ratio (CRAR) (Total Capital as a percentage of RWAs)	21.73%	22.52%
xi)	Leverage Ratio*		
xii)	Percentage of the shareholding of a) Government of India b) State Government (specify name)\$ c) Sponsor Bank\$		
xiii)	Amount of paid-up equity capital raised during the year	-0.15%	-0.15
xiv)	Amount of non-equity Tier 1 capital raised during the year, of which: Give list 7 as per instrument type (perpetual non-cumulative preference shares, perpetual debt instruments, etc.). Commercial banks (excluding RRBs) shall also specify if the instruments are Basel II or Basel III compliant.		
xv)	Amount of Tier 2 capital raised during the year, of which: Give list 8 as per instrument type (perpetual non-cumulative preference shares, perpetual debt instruments, etc.). Commercial banks (excluding RRBs) shall also specify if the instruments are Basel II or Basel III compliant.		

b) Draw down from Reserves Suitable disclosures mentioning the amount and the rationale for withdrawal shall be made regarding any draw down from reserves.

NIL



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

2. Asset liability management

a) Maturity pattern of certain items of assets and liabilities -Current Year

(Amount in ₹ crore)

	Day 1	2 to 7 days	8 to 14 days	15 to 28 Days	29 days to 3 months	Over 3 months and up to 6 months	Over 6 months and up to 1 year	Over 1 year and up to 3 years	Over 3 years and up to 5 years	Over 5 years	Total
Deposits	50.68	2.56	3.89	7.09	28.21	83.37	60.98	661.03	47.11	233.96	1178.88
Advances	72.48	2.83	3.11	49.22	26.26	40.30	83.92	303.62	111.04	67.53	760.31
Investments	10.00	19.82	4.90	19.90	44.19	39.05	2.04	3.97	0.00	285.65	429.52
Borrowings	0	0	0	0	0	0	0	0	0	0	0
Foreign Currency assets	0	0	0	0	0	0	0	0	0	0	0
Foreign Currency liabilities	0	0	0	0	0	0	0	0	0	0	0

a) Maturity pattern of certain items of assets and liabilities - Previous Year

(Amount in ₹ crore)

	Day 1	2 to 7 days	8 to 14 days	15 to 28 Days	29 days to 3 months	Over 3 months and up to 6 months	Over 6 months and up to 1 year	Over 1 year and up to 3 years	Over 3 years and up to 5 years	Over 5 years	Total
Deposits	47.33	3.83	2.00	6.92	28.84	31.55	63.94	645.72	27.40	169.83	1027.36
Advances	66.53	2.45	3.38	8.27	29.83	43.12	93.83	288.12	103.77	65.02	704.31
Investments	22.00	9.99	0.00	14.85	19.46	0.00	0.00	4.58	15.53	234.87	321.28
Borrowings	0	0	0	0	0	0	0	0	0	0	0
Foreign Currency assets	0	0	0	0	0	0	0	0	0	0	0
Foreign Currency liabilities	0	0	0	0	0	0	0	0	0	0	0

Fixed Assets - Valuation / Revaluation

Revaluation of Fixed Assets is NIL - Hence No Disclosure Required.

b) Liquidity coverage ratio (LCR) - Not applicable to UCBs

c) Net Stable Funding ratio (NSFR) - Not Applicable to UCBs



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

3. Investments

a) Composition of Investment Portfolio As on 31.03.2026

(Amount in ₹ crore)

	Investments in India						Investments outside India					
	Government Securities	Other Approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and/or joint ventures	Others	Total investments in India	Government securities (including local authorities)	Subsidiaries and/or joint ventures	Others	Total Investments outside India	Total Investments
Held to Maturity												
Gross	256.5600						256.5600					256.5600
Less: Provision for nonperforming investments (NPI)	0.00000						0.00000					0.00000
Net	256.5600						256.5600					256.5600
Available for Sale												
Gross	172.5200		0.0076			10.0000	182.5276					182.5276
Less: Provision for depreciation and NPI	9.5600		0.0006			0.00000	9.5606					9.5606
Net	162.9600		0.0070			10.0000	172.9670					172.9670
Held for Trading												
Gross							0.00000					0.00000
Less: Provision for depreciation and NPI							0.00000					0.00000
Net	0.00000		0.00000			0.00000	0.0000					0.0000
Total Investments	429.0800	0.00000	0.0076	0.00000	0.00000	10.0000	439.0876					439.0876
Less: Provision for non performing investments	0.00000	0.00000	0.0000	0.00000	0.00000	0.0000	0.0000					0.0000
Less: Provision for depreciation and NPI	9.5600	0.00000	0.0006	0.00000	0.00000	0.0000	9.5606					9.5606
Net	419.5200	0.00000	0.0070	0.00000	0.00000	10.0000	429.5270					429.5270



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

As at 31.03.2025

	Investments in India					Investments outside India		
	Government Securities	Other Approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and/or joint ventures	Others	Government securities (including local authorities)	Total Investments outside India
Held to Maturity								
Gross	97.5105							97.5105
Less: Provision for nonperforming investments (NPI)	0.0000							0.0000
Net	97.5105							97.5105
Available for Sale								
Gross	202.3600		0.0076			22.0000		224.3676
Less: Provision for depreciation and NPI	0.6000		0.0006			0.0000		0.6006
Net	201.7600		0.0070			22.0000		223.7670
Held for Trading								
Gross								
Less: Provision for depreciation and NPI								
Net	0.0000		0.0000			0.0000		0.0000
Total Investments	299.8705	0.0000	0.0076	0.0000	0.0000	22.0000		321.8781
Less: Provision for nonperforming investments	0.0000	0.0000	0.0000	0.0000	0.0000	0.0000		0.0000
Less: Provision for depreciation and NPI	0.6000	0.0000	0.0006	0.0000	0.0000	0.0000		0.6006
Net	299.2705	0.0000	0.0070	0.0000	0.0000	22.0000		321.2775

Investment	Rs in lakh				Rs in lakh			
	Current Year		Previous Year		Current Year		Previous Year	
	HTM	AFS	HFT	TOTAL	HTM	AFS	HFT	TOTAL
SLR INVESTMENTS								
CENTRAL & STATE GOVT. SECURITIES								
Book value:	25655.58	17251.95	0.00	42907.53	9751.05	20235.76	0.00	29986.81
Face value:	26093.30	17086.77	0.00	43180.07	9968.90	20348.97	0.00	30317.87
Market value:	25692.77	16295.18	0.00	41987.95	10404.01	20295.83	0.00	30699.84
Other approved security	0	0.05	0.00	0.05	0	0.05	0.00	0.05
"NON-SLR INVESTMENTS IN SHARES / DEBT-MONEY MARKET MUTUAL FUND"	0	10.00	0.00	10.00	0	2200.00	0.00	2200.00



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

b) Movement of Provisions for Depreciation and Investment Fluctuation Reserve

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
i) Movement of provisions held towards depreciation on investments		
a) Opening balance	0.60	5.07
b) Add: Provisions made during the year	8.96	0.41
c) Less: Write off / write back of excess provisions during the year	0.00	4.88
d) Closing balance	9.56	0.60
ii) Movement of Investment Fluctuation Reserve		
a) Opening balance	12.00	12.41
b) Add: Amount transferred during the year	4.00	0.00
c) Less: Drawdown	6.87	0.41
d) Closing balance	9.13	12.00
iii) Closing balance in IFR as a percentage of closing balance of investments in AFS and HFT/Current category	5.60%	5.95%

* The above balance does not include the appropriation of current year's profit towards IFR

"Carrying value less net depreciation (ignoring net appreciation) i.e. the net amount reflected in the balance sheet

c) Sale and transfers to/from HTM category

NIL

d) Non-SLR investment portfolio

i) Non-performing non-SLR investments

(Amount in ₹ crore)

	Particulars	Current Year	Previous Year
a)	Opening balance	0.00055	0.00055
b)	Additions during the year since 1st April	0	0
c)	Reductions during the above period	0	0
d)	Closing balance	0.00055	0.00055
e)	Total provisions held	0.00055	0.00055



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

ii) Issuer composition of non-SLR investments

(Amount in ₹ crore)

Sr. No.	Issuer	Amount		Extent of Private Placement		Extent of 'Below Investment Grade' Securities		Extent of 'Unrated' Securities		Extent of 'Unlisted' Securities	
-1	-2	-3		-4		-5		-6		-7	
		Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
a)	PSUs										
b)	FIs										
c)	Banks										
d)	Private Corporates										
e)	Subsidiaries/ Joint Ventures										
f)	Others - specify	10.00755	22.00755					0.00755	0.00755	0.00755	0.00755
	Debt & Money Market Mutual Fund	10.00000	22.00000								
	SIDBI Deposit	0.00000	0.00000								
	Shares in Co.op.Institutions	0.00755	0.00755					0.00755	0.00755	0.00755	0.00755
	Total *	10.00755	22.00755	0.00000	0.00000	0.00000	0.00000	0.00755	0.00755	0.00755	0.00755
g)	Provision held towards depreciation	0.00055	0.00055					0.00055	0.00055	0.00055	0.00055
	Total * (Net off Porvisions)	10.00700	22.00700	0.00000	0.00000	0.00000	0.00000	0.00700	0.00700	0.00700	0.00700

As on Balance Sheet date the bank has held shares of Rs.5000/- of GUJARAT STATE FINANCIAL CORPORATION and RS.500/- GUJARAT STATE CO.OP.HOUSING FINANCE SOC. LTD. A'BAD., which is classified as NPA due to no dividend. The bank has held full provision under "Investment Depreciation Reserve."

As on Balance Sheet date the bank has held full provision of Rs.28.35 crore under Contingency Reserve Fund against FDR of Rs.28.35 crore with Madhavpura Mercantile Coop Bank Ltd. And Rs.0.06 crore provision under Reserve For Depletion in Asset Value against FDR of Rs.0.06 crore with Natpur Coop Bank Ltd.

e) Repo transactions (in face value terms)

(Amount in ₹ crore)

	Minimum outstanding during the year	Maximum outstanding during the year	Daily average outstanding during the year	Outstanding as on March 31
i) Securities sold under repo	0	0	0	0
a) Government securities	0	0	0	0
b) Corporate debt securities	0	0	0	0
c) Any other securities	0	0	0	0
ii) Securities purchased under reverse repo	0	0	0	0
a) Government securities	0	0	0	0
b) Corporate debt securities	0	0	0	0
c) Any other securities	0	0	0	0



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

4. Asset quality

a) Classification of advances and provisions held as on Current Year

	Standard	Non-Performing				
	Total Standard Advances	Sub-Standard	Doubtful	Loss	Total Non Performing Advances	Total
Gross Standard Advances and NPAs						
Opening Balance	670.94	1.80	24.29	12.74	38.83	709.77
Add: Additions during the year	205.29	2.91	1.34	0.00	4.25	209.54
Less: Reductions during the year*	156.50	1.80	0.70	0.00	2.50	159.00
Closing balance	719.73	2.91	24.93	12.74	40.58	760.31
*Reductions in Gross NPAs due to:						
i) Upgradation					0.00	
ii) Recoveries (excluding recoveries from upgraded accounts)					0.00	
iii) Technical/ Prudential Write-offs					0.00	
iv) Write-offs other than those under (iii) above					0.00	
Provisions (excluding Floating Provisions)						
Opening balance of provisions held	2.78	0.20	22.30	12.74	35.24	38.02
Add: Fresh provisions made during the year	0.00	0.10	0.39		0.49	0.49
Less: Excess provision reversed/ Write-off loans	0.00				0.00	0.00
Closing balance of provisions held	2.78	0.30	22.69	12.74	35.73	38.51
Net NPAs						
Opening Balance		1.80	24.29	12.74	38.83	
Add: Fresh additions during the year		2.91	1.34	0.00	4.25	
Less: Reductions during the year		1.80	0.70	0.00	0.00	
Closing Balance		2.91	24.93	12.74	43.08	
Floating Provisions						
Opening Balance						0.00
Add: Additional provisions made during the year						0.00
Less: Amount drawn down during the year						0.00
Closing balance of floating provisions						0.00
Technical write-offs and the recoveries made thereon						
Opening balance of Technical/ Prudential written-off accounts						0.00
Add: Technical/ Prudential write-offs during the year						0.00
"Less: Recoveries made from previously technical/ prudential written-off accounts during the year"						0.00
Closing balance						0.00



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષક બેંક)

a) Classification of advances and provisions held as of previous year

	Standard	Non-Performing				
	Total Standard Advances	Sub-Standard	Doubtful	Loss	Total Non Performing Advances	Total
Gross Standard Advances and NPAs						
Opening Balance	593.35	2.52	23.19	12.74	38.45	361.80
Add: Additions during the year	77.59		1.10		1.10	78.69
Less: Reductions during the year*		0.72			0.72	0.72
Closing balance	670.94	1.80	24.29	12.74	38.83	709.77
*Reductions in Gross NPAs due to:						
i) Upgradation					0.35	
ii) Recoveries (excluding recoveries from upgraded accounts)					2.63	
iii) Technical/ Prudential ¹⁶ Write-offs					0.00	
iv) Write-offs other than those under (iii) above					0.00	
Provisions (excluding Floating Provisions)						
Opening balance of provisions held	2.55	0.73	22.65	12.74	36.12	38.67
Add: Fresh provisions made during the year	0.23				0.00	0.23
Less: Excess provision reversed/ Write-off loans		0.53	0.35		0.88	0.88
Closing balance of provisions held	2.78	0.20	22.30	12.74	35.24	38.02
Net NPAs						
Opening Balance		0.00	0.00	0.00	0.00	
Add: Fresh additions during the year					0.00	
Less: Reductions during the year					0.00	
Closing Balance		0.00	0.00	0.00	0.00	
Floating Provisions						
Opening Balance						0.00
Add: Additional provisions made during the year						0.00
Less: Amount drawn down during the year						0.00
Closing balance of floating provisions						0.00
Technical write-offs and the recoveries made thereon						
Opening balance of Technical/ Prudential written-off accounts						0.00
Add: Technical/ Prudential write-offs during the year						0.00
"Less: Recoveries made from previously technical/ prudential written-off accounts during the year"						0.00
Closing balance						0.00

Ratios (in per cent)	Current Year	Previous Year
Gross NPA to Gross Advances	5.34%	5.47%
Net NPA to Net Advances	0.00%	0.00%
Provision coverage ratio	106.98%	111.79%



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

b) Sector-wise Advances and Gross NPAs

(Amount in ₹ crore)

Sr. No	Sector*	Current Year			Previous Year		
		Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector	Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector
i)	Priority Sector						
a)	Agriculture and allied activities	1.28	1.22	95.31	1.30	1.22	93.85
b)	"Advances to industries sector eligible as priority sector lending"	17.78	5.09	28.63	94.14	5.96	6.33
	Of which, Metal and Metal Products	9.19	4.74	51.58	10.81	4.27	39.54
	Food processing and Manufacturing	5.39	0.09	1.67	5.82	0.09	1.58
	Miscellaneous	1.01	0.10	9.90	0.10	0.10	100.00
c)	Paper products and Printing	2.19	0.16	7.31	2.54	0.17	6.52
d)	Services	206.80	16.78	8.11	226.30	16.74	7.40
	Personal loans	263.31	7.79	2.96	104.97	4.03	3.84
	Subtotal (i)	489.17	30.88	6.31	426.71	27.95	6.55
ii)	Non-priority Sector						
a)	Agriculture and allied activities	-	0	0.00	0	0	0.00
b)	Industry	-	0	0.00	0	0	0.00
c)	Services	-	0	0.00	0	0	0.00
d)	Personal loans	271.14	9.7	3.58	283.06	10.89	3.85
	Sub-total (ii)	271.14	9.70	3.58	283.06	10.89	3.85
	Total (i + ii)	760.31	40.58	5.34	709.77	38.84	5.47

Priority Sector Lending for F.Y.2025-2026

(All Amount in ₹ 000)

Period	ANBC/CEOBE* (Outstanding)	Overall Priority Sector (Loan outstanding)	Micro Enterprises (Loan outstanding)	Weaker Section (Loan outstanding)
Quarter 1 (June 30, 2025)	631.40	417.31	158.22	78.80
Quarter 2 (September 30, 2025)	659.26	442.77	158.55	95.43
Quarter 3 (December 31, 2025)	691.41	459.40	154.42	97.13
Quarter 4 (March 31, 2026)	709.77	489.17	171.98	106.36

(ANBC/CEOBE* as applicable on the corresponding date of the preceding year)

c) Overseas assets, NPAs and revenue --NIL

d) Particulars of resolution plan and restructuring

i) Particulars of resolution plan - NA to UCBs

ii) Details of accounts subjected to restructuring



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

		Agriculture and allied activities		Corporates (excluding MSME)		Micro, Small and Medium Enterprises (MSME)		Retail (excluding agriculture and MSME)		Total	
		Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
Standard	Number of borrowers	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	Gross Amount (₹ crore)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	Provision held (₹ crore)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Sub-Standard	Number of borrowers	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	Gross Amount (₹ crore)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	Provision held (₹ crore)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Doubtful	Number of borrowers	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	Gross Amount (₹ crore)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	Provision held (₹ crore)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Total	Number of borrowers	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	Gross Amount (₹ crore)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	Provision held (₹ crore)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil

Restructured Accounts :

	Particulars of Account Restructured	Housing Loan	SME Debt Restructuring	Others
Standard Advances Restructure	Number of Borrowers	Nil	Nil	Nil
	Amount Outstanding	Nil	Nil	Nil
	Sacrifice (diminution in the fair value)	Nil	Nil	Nil
Sub Standard Advances Restructured	Number of Borrowers	Nil	Nil	Nil
	Amount Outstanding	Nil	Nil	Nil
	Sacrifice (diminution in the fair value)	Nil	Nil	Nil
Doubtful Advances Restructured	Number of Borrowers	Nil	Nil	Nil
	Amount Outstanding	Nil	Nil	Nil
	Sacrifice (diminution in the fair value)	Nil	Nil	Nil
Total	Number of Borrowers	Nil	Nil	Nil
	Amount Outstanding	Nil	Nil	Nil
	Sacrifice (diminution in the fair value)	Nil	Nil	Nil

e) Divergence in asset classification and provisioning - Not applicable to UCBs



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

f) Disclosure of transfer of loan exposures

(i) Loans not in default that are transferred or acquired

(ii) In the case of stressed loans transferred or acquired, the following disclosures should be made:

Details of stressed loans transferred during the year (to be made separately for loans classified as NPA and SMA)			
(all amounts in ₹ crore)	To ARC	To permitted transferees	To other transferees (please specify)
No: of accounts	Nil	Nil	Nil
Aggregate principal outstanding of loans transferred	Nil	Nil	Nil
Weighted average residual tenor of the loans transferred	Nil	Nil	Nil
Net book value of loans transferred (at the time of transfer)	Nil	Nil	Nil
Aggregate consideration	Nil	Nil	Nil
Additional consideration realized in respect of accounts transferred in earlier years	Nil	Nil	Nil
Details of loans acquired during the year			
(all amounts in ₹ crore)	From SCBs, RRBs, UCBs, StCBs, DCCBs, AIFs, SFBs and NBFCs including Housing Finance Companies (HFCs)		From ARC
Aggregate principal outstanding of loans acquired	Nil		Nil
Aggregate consideration paid	Nil		Nil
Weighted average residual tenor of loans acquired	Nil		Nil

g) Fraud accounts

During the year	Current year	Previous year
Number of frauds reported	0	0
Amount involved in fraud (₹ crore)	0	0
Amount of provision made for such frauds (₹ crore)	0	0
Amount of Unamortised provision debited from other reserves' as at the end of the year (₹ crore)	0	0
Position as at the end of the year	Current year	Previous year
Number of frauds reported	19	17
Balance of Amount involved in fraud (₹ crore)	9.21	8.72
Amount of provision made for such frauds (₹ crore)	9.21	8.72
Amount of Unamortised provision debited from other reserves' as at the end of the year (₹ crore)	0	0



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

(Amounts in ₹ crore)

Format – A	Disclosures to be made in the quarters ending (RBI/2020-21/16 DOR.No.BP.BC/3/21.04.048/2020-21 August 6, 2020) (Resolution Framework for COVID-19-related Stress)				
Type of borrower	(A)	(B)	(C)	(D)	(E)
	Number of accounts where resolution plan has been implemented under this window	exposure to accounts mentioned at (A) before implementation of the plan	Of (B), aggregate amount of debt that was converted into other securities	Additional funding sanctioned, if any, including between invocation of the plan and implementation	Increase in provisions on account of the implementation of the resolution plan
Personal Loans	Nil	Nil	Nil	Nil	Nil
Corporate persons*	Nil	Nil	Nil	Nil	Nil
Of which, MSMEs	Nil	Nil	Nil	Nil	Nil
Others	Nil	Nil	Nil	Nil	Nil
Total	Nil	Nil	Nil	Nil	Nil

h) Disclosure under Resolution Framework for COVID-19-related Stress

(Amounts in ₹ crore)

Type of borrower	"Exposure to accounts classified as Standard consequent to implementation of resolution plan– Position as at the end of the previous half-year(A)"	"Of (A), aggregate debt that slipped into NPA during the half-year"	"Of (A) amount written off during the half-year"	"Of (A) amount paid by the borrowers during the half- year"	"Exposure to accounts classified as Standard consequent to implementation of resolution plan Position as at the end of this half-year"
Personal Loans	Nil	Nil	Nil	Nil	Nil
Corporate persons*	Nil	Nil	Nil	Nil	Nil
Of which MSMEs	Nil	Nil	Nil	Nil	Nil
Others	Nil	Nil	Nil	Nil	Nil
Total	Nil	Nil	Nil	Nil	Nil



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

h) Disclosure under Resolution Framework for COVID-19-related Stress Format for disclosures to be made half yearly as on March 31, 2026

(Amounts in ₹ crore)

Type of borrower	"Exposure to accounts classified as Standard consequent to implementation of resolution plan– Position as at the end of the previous half-year(A)"	"Of (A), aggregate debt that slipped into NPA during the half-year"	"Of (A) amount written off during the half-year"	"Of (A) amount paid by the borrowers during the half- year"	"Exposure to accounts classified as Standard consequent to implementation of resolution plan Position as at the end of this half-year"
Personal Loans	Nil	Nil	Nil	Nil	Nil
Corporate persons*	Nil	Nil	Nil	Nil	Nil
Of which MSMEs	Nil	Nil	Nil	Nil	Nil
Others	Nil	Nil	Nil	Nil	Nil
Total	Nil	Nil	Nil	Nil	Nil

Format – X				
Disclosures to be made in the quarters ending (RBI/2021-22/31 DOR.STR.REC.11/21.04.048/2021-22 MAY 05, 2021) (Resolution Framework – 2.0: Resolution of Covid-19 related stress of Individuals and Small Businesses)				
Sl. No	Description	Individual Borrowers		Small businesses
		Personal Loans	Business Loans	
(A)	Number of requests received for invoking resolution process under Part A	Nil	Nil	Nil
(B)	Number of accounts where resolution plan has been implemented under this window	Nil	Nil	Nil
(C)	Exposure to accounts mentioned at (B) before implementation of the plan	Nil	Nil	Nil
(D)	Of (C), aggregate amount of debt that was converted into other securities	Nil	Nil	Nil
(E)	Additional funding sanctioned, if any, including between invocation of the plan and implementation	Nil	Nil	Nil
(F)	Increase in provisions on account of the implementation of the resolution plan	Nil	Nil	Nil



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

5. Exposures

a) Exposure to real estate sector

(Amount in ₹ crore)

Category	Current year	Previous year
i) Direct exposure	182.53	190.43
a) Residential Mortgages –	153.89	143.62
Of which under Priority sector	88.28	76.65
b) Commercial Real Estate –	28.64	46.81
c) Investments in Mortgage-Backed Securities (MBS) and other securitized exposures –	0.00	0.00
i. Residential	0.00	0.00
ii. Commercial Real Estate	0.00	0.00
ii) Indirect Exposure		
Fund based and non-fund-based exposures on	0.00	0.00
National Housing Bank	0.00	0.00
Housing Finance Companies	0.00	0.00
Total Exposure to Real Estate Sector	182.53	190.43

b) Exposure to capital market - NIL in Current & Previous year

c) Risk category-wise country exposure - NIL in Current & Previous year

d) Unsecured advances

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total unsecured advances of the bank	3.62	3.62
Out of the above, amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority, etc. have been taken	0.00	0.00
Estimated value of such intangible securities	0.00	0.00

e) Factoring exposures

NA

f) Intra-group exposures

NA

g) Unhedged foreign currency exposure

NA



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

6. Concentration of deposits, advances, exposures and NPAs

a) Concentration of deposits

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total deposits of the twenty largest depositors	49.38	41.76
Percentage of deposits of twenty largest depositors to total deposits of the bank	4.19%	4.06%

b) Concentration of advances*

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total advances to the twenty largest borrowers	135.09	113.48
Percentage of advances to twenty largest borrowers to total advances of the bank	17.77%	15.99%

c) Concentration of exposures**

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total exposure to the twenty largest borrowers/customers	149.45	128.89
"Percentage of exposures to the twenty largest borrowers/customers to the total exposure of the bank on borrowers/customers"	18.42%	18.16%

d) Concentration of NPAs

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total Exposure to the top twenty NPA accounts	11.92	11.94
"Percentage of exposures to the twenty largest NPA exposure to total Gross NPAs."	29.38%	30.74%

e) Credit exposure

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
% of Credit exposure up to Rs.25 lakh to total Advances	43.87%	43.48%
% of Credit exposure up to Rs.53.30 lakh to total Advances (NEW CIRCULAR)	62.34%	62.29%

7. Derivatives

a) Forward rate agreement/Interest rate swap	The bank has not entered into any transactions in derivatives in the current and previous years.
b) Exchange traded interest rate derivatives	
c) Disclosures on risk exposure in derivatives	
i) Qualitative disclosures	
ii) Quantitative disclosures	
d) Credit default swaps	



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

8. Disclosures relating to securitisation

(Number/ Amounts in ₹ crore)

Sr. No.	Particulars	"Mar 31 (CurrentYear)"	"Mar 31 (PreviousYear)"
1.	"No of SPEs holding assets for securitisation transactions originated by the originator (only the SPVs relating to outstanding securitization exposures to be reported here)"	Nil	Nil
2.	Total amount of securitised assets as per books of the SPEs	Nil	Nil
3.	"Total amount of exposures retained by the originator to comply with MRR as on the date of balance sheet"	Nil	Nil
	"a) Off-balance sheet exposures • First loss • Others"	Nil	Nil
	"b) On-balance sheet exposures • First loss • Others"	Nil	Nil
4.	"Amount of exposures to securitisation transactions other than MRR"	Nil	Nil
	"a) Off-balance sheet exposures i) Exposure to own securitisations • First loss • Others ii) Exposure to third party securitisations • First loss • Others"	Nil	Nil
	"b) On-balance sheet exposures i) Exposure to own securitisations • First loss • Others ii) Exposure to third party securitisations • First loss • Others"	Nil	Nil
5.	"Sale consideration received for the securitised assets and gain/loss on sale on account of securitisation"	Nil	Nil
6.	"Form and quantum (outstanding value) of services provided by way of, liquidity support, post-securitisation asset servicing, etc."		
7.	"Performance of facility provided. Please provide separately for each facility viz. Credit enhancement, liquidity support, servicing agent etc. Mention percent in bracket as of total value of facility provided. (a) Amount paid (b) Repayment received (c) Outstanding amount"	Nil	Nil
8.	Average default rate of portfolios observed in the past. Please provide breakup separately for each asset class i.e. RMBS, Vehicle Loans etc	Nil	Nil
9.	"Amount and number of additional/top up loan given on same underlying asset. Please provide breakup separately for each assetclass i.e. RMBS, Vehicle Loans, etc."	Nil	Nil
10.	"Investor complaints (a) Directly/Indirectly received and; (b) Complaints outstanding"	Nil	Nil

9. Off balance sheet SPVs sponsored (which are required to be consolidated as per accounting norms) (Not applicable to UCBs)



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિડયુલ્સ બેંક)

10. Transfers to Depositor Education and Awareness Fund (DEA Fund)

(Amount in ₹ crore)

Sr. No.	Particulars	Current Year	Previous Year
i)	Opening balance of amounts transferred to DEA Fund	10.67	10.37
ii)	Add: Amounts transferred to DEA Fund during the year	1.10	0.63
iii)	Less: Amounts reimbursed by DEA Fund towards claims	0.32	0.33
iv)	Closing balance of amounts transferred to DEA Fund	11.45	10.67

The amount of DEA funds is been included in balance sheet under the head of contingent liabilities i.e. Rs. 11,44,98,993.61

11. Disclosure of complaints

a) Summary information on complaints received by the bank from customers and from the Offices of Ombudsman

Sr. No.		Particulars	Previous year	Current year
		Complaints received by the bank from its customers		
1.		Number of complaints pending at	5	5
2.		Number of complaints received	3	3
3.		Number of complaints disposed	5	5
	3.1	Of which, number of complaints	0	0
4.		Number of complaints pending at the	3	3
		Maintainable complaints received by the bank from Office of		
5.		Number of maintainable complaints	7	7
	5.1.	Of 5, number of complaints resolved	7	7
	5.2	Of 5, number of complaints resolved	0	0
	5.3	Of 5, number of complaints resolved	0	0
6.		Number of Awards unimplemented	0	0

Note: Maintainable complaints refer to complaints on the grounds specifically mentioned in Integrated Ombudsman Scheme, 2021 (Previously Banking Ombudsman Scheme, 2006) and covered within the ambit of the Scheme.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

b) Top five grounds of complaints received by the bank from customers

Grounds of complaints, (i.e. complaints relating to)	Number of complaints pending at the beginning of the year	Number of complaints received during the year	% increase/ decrease in the number of complaints received over the previous year	Number of complaints pending at the end of the year	"Of 5, number of complaints pending beyond 30 days"
1	2	3	4	5	6
Current Year					
1. ATM/Debit Cards		14	44% decrease	0	0
2. Credit Cards		0	0	0	0
3. Internet/Mobile/Electronic Banking		0	100% decrease	0	0
4. Account opening/ difficulty in operation of accounts		0	0	0	0
5. Mis-selling/Para-banking		0	0	0	0
Others		9	28.57% increase	0	0
Total		23		0	0
Previous Year					
1. ATM/Debit Cards		25	78.57% increase	0	0
2. Credit Cards		0	0	0	0
3. Internet/Mobile/Electronic Banking		12	50% decrease	0	0
4. Account opening/difficulty in		0	0	0	0
5. Mis-selling/Para-banking		0		0	0
Others		7	0	2	0
Total		44	22.22 % decrease	2	0
1. ATM/Debit Cards - 14	2. Credit Cards - 0	3. Internet/Mobile/ Electronic Banking - 0	4. Account opening/ difficulty in operation of accounts - 0		
5. Mis-selling/Para-banking - 0	6. Recovery Agents/ Direct Sales Agents - 0	7. Pension and facilities for senior citizens/ differently abled - 0	8. Loans and advances - 2		
9. Levy of charges without prior notice/ excessive charges/ foreclosure charges - 0"	10. Cheques/ drafts/ bills - 0	11. Non-observance of Fair Practices Code - 0	"12. Exchange of coins, issuance/ acceptance of small denomination notes and coins - 0"		
13. Bank Guarantees/ Letter of Credit and documentary credits - 0	14. Staff behaviour - 0	15. Facilities for customers visiting the branch/adherence to prescribed working hours by the branch, etc - 0	16. Others - 5		



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ
(શિક્ષણ બેંક)

12. Disclosure of penalties imposed by the Reserve Bank of India

Penalties imposed by the Reserve Bank of India - CURRENT YEAR
NIL

Penalties imposed by the Reserve Bank of India - PREVIOUS YEAR
Penalty of Rs.15,00,000 was levied on the bank for non compliance with IRAC Norms as per RBI Inspection Report for the Financial Year 2021-2022. The same has been remitted to RBI as on 23rd December 2024.

13. Disclosures on remuneration - Not Applicable to UCBs

14. Other Disclosures

a) Business ratios		
Particulars	Current Year	Previous Year
i) Interest Income as a percentage to Working Funds	6.51%	6.87%
ii) Non-interest income as a percentage to Working Funds	0.66%	0.67%
iii) Cost of Deposits	4.74%	4.40%
iv) Net Interest Margin	3.05%	4.18%
v) Operating Profit as a percentage to Working Funds	1.61%	2.05%
vi) Return on Assets	1.01%	1.85%
vii) Business (deposits plus advances) per employee (in ₹ crore)	13.85	11.82
viii) Profit per employee (in ₹ crore)	0.12	0.16
ix) Gross Profit per employee (in ₹ crore)	0.17	0.18



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

b) Bancassurance business

Particulars	Current Year Rs in crore	Previous Year Rs in crore
Commission received from Referral Arrangements :		
Commission income	0.4508	0.1548
PMJJBY scheme	0.0008	0.0008
PMSBY scheme	0.0000	0.0000

c) Marketing and distribution

Particulars	Current Year Rs in crore	Previous Year Rs in crore
Commission received from Bills Collection Arrangements		
GUJARAT GAS LTD.	0.007	0.003
Commission received from Estamping		
SHCIL	0.0383	0.0249

d) Disclosures regarding Priority Sector Lending Certificates (PSLCs)

Particulars	Current Year Rs in crore	Previous Year Rs in crore
The amount of PSLCs (category-wise) sold and purchased during the year	0.00	0.00

e) Provisions and contingencies

(Amount in ₹ crore)		
Provision debited to Profit and Loss Account	Current Year	Previous Year
i) Provisions for NPI		
ii) Provision towards NPA	0.00	1.90
iii) Provision made towards Income tax	5.02	6.27
iv) Other Provisions and Contingencies (with details)		
Prov.for Investment Depreciation Reserve	8.96	(4.88)
Staff Bonus Provision as per Bonus Act	0.00	0.00
Reserve for Depletion in Assets Value		



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

f) Implementation of IFRS converged Indian Accounting Standards (Ind AS) (not Applicable to RRBs, LABs, UCBs)

g) Payment of DICGC Insurance Premium

Deposit insurance premium as applicable was paid to DICGC within the prescribed timelines'

h) Disclosure of facilities granted to directors and their relatives

(Amount in ₹ crore)

Facilities extended to directors, their relatives, companies or firms in which they are interested		
	Amt. outstanding	
	Current Year	Previous Year
Fund-based	0.00	0.00
Non-Fund based (Guarantee,L/C etc.)	0.00	0.00

i) Disclosure on amortisation of expenditure on account of enhancement in family pension of employees of banks- Not applicable

(Applicable for banks covered under the 11th Bipartite Settlement and Joint Note dated November 11, 2020)



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

બેંકના કામકાજની વખતો વખતની પરિસ્થિતિ દર્શાવતું પત્રક

અ. નં.	વિગત	તા. ૩૧-૩-૩૧ ના રોજ	તા. ૩૦-૬-૫૧ ના રોજ	તા. ૩૧-૩-૧૧ ના રોજ	તા. ૩૧-૩-૨૫ ના રોજ	તા. ૩૧-૩-૨૬ ના રોજ
૧.	સભાસદની સંખ્યા (નંબર)	૭૮	૨૦૩૩	૩૨,૧૮૯	૪૦,૨૩૪	૪૦,૬૭૩
૨.	વસુલ આવેલું શેર ભંડોળ (રૂ.)	૮,૯૧૦	૧,૯૬,૩૨૫	૧૨,૪૭,૨૭,૧૫૦	૧૬,૦૬,૩૨,૮૦૦	૧૫,૯૧,૪૮,૨૦૦
૩.	ટીઝર્વ ફંડ (રૂ.)	૭૯	૧,૦૭,૫૯૧	૨૯,૮૪,૦૩,૦૦૨	૮૫,૪૨,૬૫,૦૬૭	૯૨,૨૨,૯૭,૮૬૦
૪.	બીજા ફંડો (રૂ.)	--	૧,૨૦,૭૪૪	૬૪,૬૬,૪૭,૧૭૬	૯૬,૬૭,૦૦,૩૯૫	૧,૧૧,૦૧,૮૦,૯૫૪
૫.	થાપણો (રૂ.)	૫૯,૩૯૨	૨૯,૧૫,૫૯૨	૩,૬૨,૨૮,૦૧,૧૮૧	૧૦,૨૭,૩૫,૫૩,૧૩૮	૧૧,૭૮,૮૮,૫૬,૧૮૭
૬.	ધીરાણો (રૂ.)	૨૬,૦૧૨	૧૩,૨૨,૭૪૮	૧,૮૯,૪૯,૫૫,૯૨૯	૭,૦૯,૭૭,૪૨,૨૧૮	૭,૬૦,૩૦,૫૫,૪૩૯
૭.	ધીરાણ પૈકીની ઓવરડ્યુ રકમ (રૂ.)	--	૪૧,૩૦૦	૨૮,૧૧,૩૧,૭૦૬	૩૮,૩૦,૦૫,૯૩૫	૪૯,૭૬,૨૮,૫૩૭
૮.	સરકારી જામીનગીરીઓમાં અને અન્ય રોકાણો (રૂ.)	--	૭,૭૩,૪૬૯	૧,૩૬,૨૭,૪૨,૮૨૫	૩,૨૧,૮૭,૫૭,૧૫૮	૪,૩૯,૦૮,૨૮,૭૭૮
૯.	પૂરા થતા વર્ષની આવક (રૂ.)	૧,૭૧૨	૭૬,૩૩૭	૩૮,૭૪,૩૨,૧૮૨	૯૬,૬૯,૯૫,૧૮૧	૧,૦૪,૭૨,૬૬,૧૯૫
૧૦.	પૂરા થતા વર્ષનો ખર્ચ તથા બીજી રકમો	૮૭૩	૪૨,૫૯૨	૩૫,૦૪,૮૪,૫૩૦	૭૩,૮૭,૪૫,૭૨૧	૮૮,૩૫,૩૧,૫૨૮
૧૧.	પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો (રૂ.)	૮૩૯	૩૩,૭૪૫	૩,૬૯,૪૭,૬૫૨	૨૨,૮૨,૪૯,૪૬૦	૧૬,૩૭,૩૪,૬૬૬
૧૨.	ડીવીડન્ડ %	૫.૨૫ %	૬.૨૫ %	૧૫ %	૨૦ % (સુચિત)	૨૦ % (સુચિત)
૧૩.	કામકાજનું ભંડોળ (રૂ.)	૬૯,૯૧૫	૩૪,૮૩,૧૩૯	૪,૮૮,૦૨,૩૮,૨૧૨	૧૭,૩૭,૧૨,૯૫,૩૫૬	૧૯,૩૯,૧૯,૧૧,૬૨૬



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

સભાસદો માટે અગત્યની જાહેરાત

બેંકના માનવંતા સભાસદો, થાપણદારો તથા કરજદારો જોગ

૧. સભાસદોએ તેમના શેર માટે તથા થાપણદારોએ થાપણો માટે તથા ખાતેદારોએ પોતાના ખાતામાં નોમીનેશન કરાવી લેવું. જેથી તેમની હયાતી બાદ શેર અગર થાપણની રકમ/ખાતાની રકમ પોતાની ઇચ્છિત વ્યક્તિને (નોમીનીને) મળી શકે. લોકર માટે નોમીનેશનની સવલત ઉપલબ્ધ છે.
૨. બેંક દરેક સભાસદને ઓળખપત્ર આપે છે જેથી દરેક સભાસદે બેંકને બે ફોટા આપી પોતાનું ઓળખપત્ર મેળવી લેવું જરૂરી છે. ચૂંટણીમાં મતદાન વખતે તથા વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપતી વખતે આ ઓળખપત્ર લાવવું જરૂરી છે.
૩. ગુજરી ગયેલા સભાસદોના વારસો/નોમીનીએ શેર ટ્રાન્સફર માટે જરૂરી પેપર્સ સાથેની અરજી જે તે પ્રાન્થમાં રજુ કરવી અને શેર ટ્રાન્સફર કરાવી લેવા.
૪. જે સભાસદોના સેવિંગ્સ ખાતા આપણી બેંકમાં ન હોય તેમણે જે તે શાખાના ખાતા ખોલાવી લેવા, જેથી ડિવિડન્ડની રકમ ખાતામાં ચુકવી શકાય.
૫. કુલ રૂ. ૨૫ લાખ કે તેથી વધુ ઓવરડ્રાફ્ટ ધીરાણવાળા ખાતાઓમાં કેટલીક ચોક્કસ શરતોનું પાલન થયેથી સીલેક્ટીવ વ્યાજ દરનો લાભ આપવામાં આવે છે. આ બાબતે વધુ વિગતો શાખા મેનેજર પાસેથી મળી શકશે.
૬. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સરક્યુર મુજબ કુટુંબ (પતિ/પત્ની, અપરિણીત સંતાનો) ના સભ્યોની કુલ આવક રૂ. ૩.૦૦ લાખ સુધીની હોય તેમને માર્ફકો ફાઈનાન્સ ધીરાણ રૂ. ૧.૦૦ લાખ સુધી મળી શકશે.
૭. વ્યક્તિગત ધીરાણ સહિત તમામ અરજદારો (ભાગીદારી પેઢી, પ્રાઈવેટ લિ. કંપની, ટ્રસ્ટ HUF વગેરે) ને મિલકતના તારણ સામે ઓવરડ્રાફ્ટ ફેસીલીટી ૮.૯૯ % થી શરૂ, ટર્મલોન (મિલકતના તારણ સામે) ૧૨૦ EMI થી ૮.૯૯% ના વ્યાજના દરે શરૂ, રીયેલાઈઝેશન વેલ્યુ ના ૭૫% સુધી ધીરાણ આપવાનું ચાલુ છે. ઓવરડ્રાફ્ટ ફેસીલીટી માટે દર વર્ષે ૧૦% જેટલી લિમીટ ઘટાડી રીન્યુ કરવાની રહેશે.
૮. બાંધી મુદતની થાપણો ઉપર માસિક / ત્રિમાસિક / છમાસિક વાર્ષિક ધોરણે વ્યાજ ચુકવવામાં આવે છે.
૯. વરિષ્ઠ નાગરિકો માટે થાપણ યોજનામાં એક વર્ષથી વધુ મુદતની થાપણો ઉપર ૦.૫% થી ૦.૭૫% સુધી વધુ વ્યાજ આપવામાં આવે છે. નવી રીકર્ડીંગ સ્કીમ, ટોપ-અપ લોન ચાલુ છે.
૧૦. બેંકની દરેક શાખાઓમાં ગુજરાત ગેસ કં. ના રૂપિયા ૧૦,૦૦૦/- સુધીના બીલો સ્વીકારવામાં આવે છે.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

વ્યાજમાંથી આવકવેરા (TDS) કપાત બાબતે થાપણદારોને ખાસ સૂચના

- ☞ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં રજુ થયેલ કેન્દ્રિય બજેટ મુજબ રિકર્ડિંગ ડિપોઝીટ સહિત ની ટર્મ ડિપોઝીટ નું વ્યાજ બેંક ની બધી શાખાઓ સહિત વાર્ષિક રૂ. ૫૦,૦૦૦/- થી વધુ થતું હોય તો નીચે મુજબ અમલ માં આવે તે રીતે TDS કપાત કરવામાં આવે છે. સિનિયર સીટીઝન માટે આ TDS મુક્ત વ્યાજની લીમીટ રૂ. ૧,૦૦,૦૦૦/- છે.
- ☞ ખાતેદાર જે તે નાણાકીય વર્ષ માટે તે વર્ષ માં સૂચિત મર્યાદા સુધીની વ્યાજની આવક પર TDS કપાત ન થાય તે માટે ભરવામાં આવતા ફોર્મ નં 15 H અને 15 G ના બદલે હવેથી (TDS ના નિયમ ને આધીન) ફોર્મ નં. ૧૨૧ હવેથી સ્વીકારમાં આવશે.
- ☞ જો ખાતેદારે / સભાસદે બેંકમાં PAN Card No. આપ્યો હોય તો ૧૦ ટકા મુજબ TDS કપાશે.
- ☞ જો ખાતેદારે / સભાસદે બેંકમાં PAN Card No. ન આપ્યો હોય તો (ઈન્કમ ટેક્સ એક્ટ ના નિયમો પ્રમાણે) ૨૦ ટકા મુજબ TDS કપાશે.
- ☞ જો ખાતેદાર / સભાસદ ઈન્કમ ટેક્સ ઓથોરીટી પાસેથી TDS કપાત ન કરવા બાબતનું સર્ટીફિકેટ રજુ કરે તો તો સર્ટિફિકેટમાં જણાવેલ જોગવાઈઓ પ્રમાણે તેમની TDS કપાત કરવામાં આવશે નહીં.
- ☞ બેંકના સભાસદ કે નોમીનલ મેમ્બરની ટર્મ ડીપોઝીટ / રીકર્ડિંગ ડીપોઝીટ પણ TDS કપાતને પાત્ર રહેશે.
- ☞ તા. ૧/૭/૨૦૨૩ થી આધાર, પાન કાર્ડ લોક ના હોય તો પાનકાર્ડ valid ગણાશે નહીં અને હાયર ટેક્સ રેટ લાગુ પડે છે.
- ☞ ITR નહીં ભર્યું હોય તો હાયર ટેક્સ રેટ લાગશે.

બેંકના તમામ ખાતેદારો / લોકર ધારકો જોગ ખાસ સૂચના

- ☞ ગુજરાત સરકારનાં તા. ૦૭-૦૭-૨૦૧૫ ના નોટીફિકેશન અંતર્ગત રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના પરિપત્ર નં. DBR/AML. No. 17351 / 14.02.030/2014-15, તા. ૧૮-૦૫-૨૦૧૫ તથા પરિપત્ર નં. RBI/DBR/2015-16/18 તા. ૨૫-૦૨-૨૦૧૬ મુજબ દરેક બેંકને CKYCR (સેન્ટ્રલ KYC રજીસ્ટ્રી) પ્રક્રિયા ફરજિયાત કરવાની સૂચના છે.
- ☞ ઉપરોક્ત સંજોગોમાં, સર્વે ગ્રાહકોને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે જેઓએ બેંકમાં અગાઉ KYC ડોક્યુમેન્ટ્સ રજુ કરેલા હોય તેમ છતાં REKYC ડ્યુ હોય તો હાલનાં / તાજા / નવા KYC ડોક્યુમેન્ટ (PAN/Aadhar કાર્ડ) વિગેરે તાજેતરનો ફોટો, ID Proof, Address Proof નિર્ધારિત CIF ફોર્મ સહિત સત્વરે, આપનું જે શાખામાં ખાતું હોય તે શાખામાં રજુ કરવા વિનંતી છે. ખાતામાં એક કરતા વધુ જોઈન્ટ હોલ્ડર હશે તો તે બધાના KYC પુરાવા આપવાના રહેશે. CIF ફોર્મ જે તે શાખામાંથી મેળવી લેવાનું રહેશે.
- ☞ લોકર ધારકોએ Key Embossing કરાવવાની બાકી હોય તેમણે જે તે શાખાનો સંપર્ક કરી Key Embossing કરાવી લેવાનું રહેશે. તેમજ તા. ૩૧-૧૨-૨૦૨૩ પહેલા લીધેલ લોકર ખાતેદારોએ તેમના લોકરના નવા બોન્ડ (લેટેસ્ટ KYC સાથે) જે-તે શાખામાં બનાવવાના રહેશે.
- ☞ જે લોકરધારકોએ નવા લોકર બોન્ડ બનાવેલ ન હોય તેઓએ નવા લોકર બોન્ડ બનાવી જે તે પ્રાંચના જમા કરવવાના રહેશે કાર્યવાહી બાકી હોય તેવા લોકરધારકોના લોકર FREEZE કરવામાં આવેલ છે. ફરજિયાત પણે આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ લોકર ઓપરેટ કવી શકાશે.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

કોમ્પ્યુટરાઈઝ્ડ સેવાઓ :

અઘતન ટેકનોલોજી થકી ગ્રાહક સેવાઓ સુધારવા માટે બેંકે નીચે જણાવેલ સેવાઓ શરૂ કરી છે.

૧. આપણી બેંકની ૧૧ શાખાઓ પૈકી ૧૦ શાખા પર ATM ની સેવા ઉપલબ્ધ છે.
(પારનેરા માં ફેબ્રુઆરી-૨૦૨૬ થી ATM ની સેવા ચાલુ કરવામાં આવેલ છે.)
૨. બેંક ના ATM/Debit Cards દ્વારા ATM ઉપરાંત POS અને E-COM સેવાઓનો પણ લાભ લઈ શકાય છે. POS સેવાથી ગ્રાહકો મોલ, પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાઓએ કાર્ડ સ્વાઈપ કરી BILL ની ચુકવણી કરી શકે છે. અને E-COM સેવા દ્વારા તમામ પ્રકારના ONLINE PAYMENT, CARD NUMBER નો ઉપયોગ કરી શકે છે.
૩. ગ્રાહકો તેમના ખાતાના વ્યવહારો, ડીપોઝીટ તથા લોનના બેલેન્સ વિગેરે ઇન્ટરનેટ પર ઘરબેઠા જોઈ કે છાપી શકે તે માટે બેંકે ઇન્ટરનેટ બેન્કિંગ “ વ્યુ ઓન્લી” શરૂ કરેલ છે.
૪. બેંકે NEFT/RTGS ની સેવાઓને વધુ આધુનિક કરી છે તે થકી ગ્રાહકો તેમના આ પ્રકારના વ્યવહારોના UTR Number SMS થી મોબાઈલ ઉપર મેળવી શકે છે. અને તેના માટે બેંકમાં આવવાની કે ફોન કરવાની જરૂર પડતી નથી.
૫. બેંકની વિવિધ સ્કીમોની જાણકારી બેંકની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે, જેથી ગ્રાહકોને ઘરે બેઠા તેની જાણકારી મળી રહે. (<https://www.sbpp.bank.in>)
૬. સ્માર્ટ ફોન ઉપર નાણાંકીય વ્યવહાર (IMPS/RTGS/NEFT) CHEQUE BOOK REQUEST, BALANCE ENQUIRY અને STATEMENT REQUEST થઈ શકે એ માટે “એપ” લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ દ્વારા NEFT/RTGS સેવા પણ ચાલુ કરેલ છે. આ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા ગ્રાહકોને વિનંતી.
૭. લોનધારકો અન્ય બેંક ના પોતાના ખાતામાંથી Mandate દ્વારા આપણી બેંકની લોનના EMI નું સરળતાથી Payment કરી શકે છે.
૮. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ડીપોઝીટ પાકતી મુદત જો બીજી કોઈ Maturity Instruction ન હોય તો બેંક દ્વારા ઓટો રીન્યુ કરવામાં આવી રહી છે.
૯. ગ્રાહકોને તેમની ડીપોઝીટ મેચ્યોર્ડ થાય, તેમના લોનના હપ્તા ડ્યુ થાય, તેમના ખાતામાં ચેક આવે, ઇન્સ્યુરન્સ પોલીસી ડ્યુ થાય તેવા અગત્યના રીમાઈન્ડર્સ SMS બેંક દ્વારા મોકલવા માં આવે છે.
૧૦. બેંકના ગ્રાહકોને NACH/DBTL/ECS તથા SMS ની સેવાઓ મળી શકે તે માટે જરૂરી વ્યવસ્થા NPCI ના સહયોગથી કરવામાં આવી છે.
- ૧૧ ગ્રાહક માટે ATM/DEBIT CARD ના MANAGEMENT માટે CARD SAFE APP LAUNCH કરવામાં આવેલ છે. આ સેવાઓનો વધુમાં વધુ ગ્રાહકોને લાભ લેવા વિનંતી.
૧૨. બેન્ક UPI Channel દ્વારા કસ્ટમર ગુગલ પે, Paytm, Bhim જેવી ડીજિટલ Application ની ઉપયોગ થી નાણાંની લેવડ-દેવડ કરી શકાશે.
૧૩. Complaint redressal માટે CMS Portal Launch કરેલ છે. જેમાં Complaint કરી શકાય અને કરેલ Complaint ની પરિસ્થિતિ જાણી શકાય. Complaint ની update SMS / EMAIL Website : <https://cms.sbpp.bank.in> થી જાણ કરવામાં આવે છે.
૧૪. બેંક દ્વારા Tap and Pay (wireless) debit card issue કરવામાં આવી રહ્યા છે.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

વાર્ષિક પુરવણી પત્રક નંબર ૨
બેંકનાં પેટાનિયમોમાં સુધારા વધારા કરવા બાબત.

પેટાનિયમ નંબર	સુધારા પછી નવો પેટાનિયમ	સુચિત સુધારાનાં કારણો
નવો ઉમેરો	બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કુલ સભ્યો પૈકી : (a) ઓછામાં ઓછા એકાવન ટકા (51%) સભ્યો એવા હોવા જોઈએ કે જેઓ નીચે દર્શાવેલ એક અથવા વધુ વિષયોમાં વિશેષ જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ ધરાવતા હોય: (i) હિસાબીશાસ્ત્ર (Accountancy) (ii) કૃષિ અને ગ્રામિણ અર્થતંત્ર (Agriculture and Rural Economy) (iii) બેન્કિંગ (Banking) (iv) સહકાર (Co-operation) (v) અર્થશાસ્ત્ર (Economics) (vi) નાણાશાસ્ત્ર (Finance) (vii) કાયદો (Law) (viii) લઘુ ઉદ્યોગ (Small Scale Industry) (ix) અન્ય કોઈ એવો વિષય કે જેમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ બેંક માટે ઉપયોગી હોવાનું ભારતીય રિઝર્વ બેંકના મતે ગણાય. વધુમાં, ઉપરોક્ત લાયકાત ધરાવતા ડિરેક્ટરો પૈકી ઓછામાં ઓછા બે ડિરેક્ટરો એવા હોવા જોઈએ કે જેઓ કૃષિ અને ગ્રામિણ અર્થતંત્ર, સહકાર અથવા લઘુ ઉદ્યોગ ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ ધરાવતા હોય. અને (b) નીચે મુજબ ન હોવો જોઈએ — (1) નીચે દર્શાવેલ પૈકીની કોઈ સંસ્થા સાથે નોકરીયાત, મેનેજર અથવા મેનેજિંગ એજન્ટ તરીકે નોંધપાત્ર હિત (substantial interest) ધરાવતો અથવા સંકળાયેલો ન હોવો જોઈએ— (i) કંપની અધિનિયમ, 1956 ની કલમ 25 હેઠળ નોંધાયેલ કંપની સિવાયની કોઈપણ કંપની; અથવા (ii) કોઈપણ એવી પેઢી (Firm), જે કોઈ વેપાર, વાણિજ્ય અથવા ઉદ્યોગ ચલાવતી હોય અને જે કોઈ પણ કિસ્સામાં લઘુ ઉદ્યોગ એકમ (Small-scale Industrial Concern) ન હોય; અથવા (2) કોઈપણ એવા વેપારી, વાણિજ્યિક અથવા ઔદ્યોગિક એકમનો માલિક (Proprietor) ન હોવો જોઈએ, જે લઘુ ઉદ્યોગ એકમ (Small-scale Industrial Concern) ન હોય.	બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 10A(2) ની જોગવાઈઓ તા. 1 ઓગસ્ટ, 2025 થી અર્બન કો-ઓપરેટિવ બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી આ સુધારો કરવામાં આવે છે.



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

નવો ઉમેરો	નીચે જણાવેલ વ્યક્તિઓ ડિરેક્ટર તરીકે પાત્ર ગણાશે નહીં: (1) જે કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં નોંધપાત્ર હિત (Substantial Interest) ધરાવતી હોય અથવા કર્મચારી, મેનેજર અથવા મેનેજિંગ એજન્ટ તરીકે સંકળાયેલી હોય, જો કે આવી કંપની: (i) કંપનીઝ એક્ટ, 1956 ની કલમ 25 હેઠળ નોંધાયેલ કંપની ન હોય; અથવા (ii) એવી કોઈ પેઢી (Firm) સાથે સંકળાયેલી હોય કે જે વેપાર, વાણિજ્ય અથવા ઉદ્યોગ ચલાવતી હોય અને જે લઘુ ઉદ્યોગ (Small Scale Industrial Concern) ન હોય. (2) કોઈ એવી વેપારી, વાણિજ્યિક અથવા ઔદ્યોગિક સંસ્થાના માલિક (Proprietor) હોય કે જે લઘુ ઉદ્યોગ તરીકે વર્ગીકૃત ન થતી હોય.	બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 10A(2) ની જોગવાઈઓ તા. 1 ઓગસ્ટ, 2025 થી અર્બન કો-ઓપરેટિવ બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી આ સુધારો કરવામાં આવે છે.
નવો ઉમેરો	જો કોઈપણ સમયે સંબંધિત પેટા નિયમમાં નિર્ધારિત કરેલ જોગવાઈઓનું પાલન થતું ન હોય, તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બોર્ડનું પુનર્ગઠન (Re-constitution) કરવું પડશે જેથી ઉપરોક્ત જોગવાઈઓનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત થઈ શકે. જો સંબંધિત પેટા નિયમની પેટા કલમ મુજબ બોર્ડનું પુનર્ગઠન (Re-constitution) કરવા માટે કોઈ ડિરેક્ટર અથવા ડિરેક્ટરોને નિવૃત્ત કરવાનું જરૂરી બને, તો બોર્ડ ચિકી ઉપાડવાની (Draw of Lots) નિર્ધારિત પદ્ધતિ દ્વારા નક્કી કરશે કે કયા ડિરેક્ટર અથવા ડિરેક્ટરો પદ પરથી નિવૃત્ત થશે. બોર્ડનો આ નિર્ણય તમામ ડિરેક્ટરો માટે બંધનકર્તા રહેશે.	બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 10A(2) ની જોગવાઈઓ તા. 1 ઓગસ્ટ, 2025 થી અર્બન કો-ઓપરેટિવ બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી આ સુધારો કરવામાં આવે છે.
નવો ઉમેરો	RBI દ્વારા જારી કરવામાં આવેલ બ્રાન્ચ ઓથોરાઈઝેશનમાં નોર્મ્સનું પાલન થતું હશે અને પૂરતા પ્રમાણમાં હેડરૂમ કેપીટલ હશે તો, એક ફાઈનાન્સીયલ વર્ષ દરમિયાન બેન્ક તેના સ્ટેટ ઓફ રજીસ્ટ્રેશનના પોતાની પસંદગીના વધુમાં વધુ ત્રણ ડિસ્ટ્રીક્ટ કાર્યક્ષેત્રમાં ઉમેરી શકશે જેના માટે RBI ની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં. પરંતુ જો ઉપર દર્શાવ્યા પ્રમાણે ત્રણ ડિસ્ટ્રીક્ટથી વધુ ડિસ્ટ્રીક્ટને કાર્યક્ષેત્રમાં ઉમેરવાના હશે તો RBI ની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.	RBIના તા.૨૬-૧૧-૨૦૨૫ ના બ્રાન્ચ ઓથોરાઈઝેશન ના પરિપત્રના પેરા નંબર-૧૪નું પાલન કરવા.
નવો ઉમેરો	સંચાલક મંડળના સભ્ય સતત દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરતા, સંચાલક મંડળના સભ્ય તરીકે રહી શકશે નહીં. આ રીતે ફારેગ થયેલા સંચાલક મંડળના સભ્ય RBI દ્વારા વખતો વખત જે Cooling off period ની જોગવાઈ જાહેર કરવામાં આવે તેટલા સમયનો Cooling off period પછીજ સંચાલક મંડળના સભ્ય તરીકે ચુંટાવાને પાત્ર થશે. આ Cooling off period દરમિયાન તે બેન્કના માત્ર સભાસદ તરીકે ચાલુ રહી શકશે. આ સિવાય અન્ય કોઈ રીતે (જેમકે સલાહકાર/ કમીટી મેમ્બર/ BOM ના સભ્ય વગેરે) બેન્ક સાથે	બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1948(AACS) ની કલમ 10A(2A)(i) તેમજ RBI ના તા.૨૫-૦૫-૨૦૨૬ના સરકયુલર No.DOR.GOV. REC.NO.82/18.10.0 14/2026-27 (Urban Co-Operative Banks-



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિક્ષણ બેંક)

	સંકળાઈ શકશે નહીં. ફરેગ થયેલ સંચાલક મંડળના કોઈપણ સભ્ય જો RBI એ જણાવેલ Cooling off period કરતાં ઓછા સમયગાળાનો Cooling off period લીધેલ હશે તો તે Cooling off period ને સંચાલક મંડળના સભ્ય તરીકેની સતત ટર્મમાં બ્રેક તરીકે ગણવામાં નહીં આવે.	Governance) ની જોગવાઈનું પાલન કરવા
નવો ઉમેરો	જરૂરિયાત પ્રમાણે બેન્કની વાર્ષિક સાધારણ સભા Online (Virtual) mode માં કરી શકાશે. RBI તથા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ દ્વારા વખતોવખત કરવામાં આવતાં સુધારાઓ / સરક્યુલર / સૂચનોનું અમલ બેન્કે કરવાનું રહેશે.	વહીવટી સુગમતા ખાતર



મો
વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિડયુલ્સ બેંક)

:: શાખાઓ ::

હેડ ઓફિસ

સ્થાપના : તા. ૧-૧-૧૯૩૦

પારસી સ્ટ્રીટ,
કિલ્લા પારડી - ૩૯૬ ૧૨૫
ફોન : (૦૨૬૦) ૨૩૭૩૨૭૦
૨૩૭૩૫૨૮
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૦૧
E-mail : contact@pardipeoplesbank.in

કિલ્લા પારડી શાખા

સ્થાપના : તા. ૧-૧-૧૯૩૦

પારસી સ્ટ્રીટ,
કિલ્લા પારડી - ૩૯૬ ૧૨૫
ફોન : (૦૨૬૦) ૨૩૭૩૨૬૦
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૦૨
IFSC CODE : UTIB0SBPP02
MICR CODE : 396804501

વાપી શાખા

સ્થાપના : તા. ૧૭-૧૦-૧૯૩૩

બજાર રોડ,
વાપી - ૩૯૬ ૧૯૧.
ફોન : (૦૨૬૦) ૨૪૬૨૧૦૧
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૦૩
IFSC CODE : UTIB0SBPP03
MICR CODE : 396804032

ઉદવાડા સ્ટેશન શાખા

સ્થાપના : તા. ૨૦-૭-૧૯૫૧

ઉદવાડા સ્ટેશન,
ઉદવાડા - ૩૯૬ ૧૮૫
ફોન : (૦૨૬૦) ૨૩૪૨૩૯૮
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૦૪
IFSC CODE : UTIB0SBPP04
MICR CODE : 396804502

જી.આઈ.ડી.સી. શાખા

સ્થાપના : તા. ૧૩-૨-૧૯૭૩

પો. બો. નં. ૬૨, ચાર રસ્તા,
જી.આઈ.ડી.સી. વાપી - ૩૯૬ ૧૯૫.
ફોન : (૦૨૬૦) ૨૪૩૧૭૭૬
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૦૫
IFSC CODE : UTIB0SBPP05
MICR CODE : 396804031

પારનેરા શાખા

સ્થાપના : તા. ૨૪-૧૧-૧૯૭૮

ભોલા નગર, અતુલ ફર્સ્ટ ગેટ,
પારનેરા. જી. વલસાડ - ૩૯૬૦૨૦
ફોન : (૦૨૬૩૨) ૨૩૩૬૮૩
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૦૬
IFSC CODE : UTIB0SBPP06
MICR CODE : 396804503

કોપરલી રોડ વાપી શાખા

સ્થાપના : તા. ૧૬-૧-૧૯૯૦

ગુંજન સિનેમા નજીક,
જી.આઈ.ડી.સી.
વાપી - ૩૯૬૧૯૫
ફોન : (૦૨૬૦) ૨૪૦૦૩૦૧
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૦૮
IFSC CODE : UTIB0SBPP08
MICR CODE : 396804033

ચણોદ શાખા

સ્થાપના : તા. ૨૦-૧૨-૧૯૯૭

દુકાન નં ૧ થી ૬,
શ્રી રામ એપાર્ટમેન્ટ, પ્લોટ નં. ૩૮,
ભુલાનગર, ચણોદ, તા. વાપી,
જી. વલસાડ - ૩૯૬ ૧૯૫
ફોન : (૦૨૬૦) ૨૪૫૦૩૫૧
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૦૭
IFSC CODE : UTIB0SBPP07
MICR CODE : 396804034

ચલા શાખા

સ્થાપના : તા. ૨-૨-૧૯૯૮

દુકાન નં ૧૫ થી ૧૯,
તિરૂપતી પ્લાઝા બિલ્ડીંગ,
વાપી - દમણ રોડ,
ચલા - વાપી - ૩૯૬૧૯૧
ફોન : (૦૨૬૦) ૨૪૬૩૬૪૫
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૧૦
IFSC CODE : UTIB0SBPP10
MICR CODE : 396804035

ભીલાડ શાખા

સ્થાપના : તા. ૧૭-૮-૧૯૯૮

સરીગામ રોડ,
બેંક ઓફ બરોડા નજીક,
ભીલાડ - ૩૯૬ ૧૦૫
ફોન : (૦૨૬૦) ૨૭૮૫૦૭૦
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૦૯
IFSC CODE : UTIB0SBPP09
MICR CODE : 396804504

વલસાડ શાખા

સ્થાપના : તા. ૩-૨-૧૯૯૯

સરકીટ હાઉસ સામે,
કલાસીક એપાર્ટમેન્ટ,
હાલર રોડ, વલસાડ - ૩૯૬૦૦૧
ફોન : (૦૨૬૩૨) ૨૪૯૨૮૪
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૧૧
IFSC CODE : UTIB0SBPP11
MICR CODE : 396804001

ધરમપુર શાખા

સ્થાપના : તા. ૬-૮-૨૦૧૫

મોટા બજાર,
નગરપાલિકા ઓફિસ નજીક,
ધરમપુર - ૩૯૬ ૦૫૦
ફોન : (૦૨૬૩૩) ૨૪૩૩૮૮
મોબાઈલ : ૬૩૫૭૯૩૭૬૧૨
IFSC CODE : UTIB0SBPP12
MICR CODE : 396804191



એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (શિડયુલ બેંક)



“PARNERA BRANCH OPENING”



“PRIZE DISTRIBUTION FUNCTION”

: હેડ ઓફિસ :

પારસી સ્ટ્રીટ, કિલ્લા પારડી - ૩૯૬ ૧૨૫, જી. : વલસાડ, (ગુજરાત)

E-mail : contact@pardipeoplesbank.in

Web Site : <https://sbpp.bank.in>

Mob. : 6357937601